https://archive.org/details/bk107/page/n0/mode/1up

1995-01 -Satpanth Jyot (107)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

સતપંથ જ્યોત

વર્ષ : ૨
અંક : ૩
સળંગ અંક : ૧૫

જાન્યુઆરી
૧૯૯૫

: પ્રકાશક :
સતપંથ પ્રકાશન સમિતિ
શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા-૩૮૨૪૨૫
તા. દસક્રોઈ, જિ. અમદાવાદ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk107/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk107/page/n2/mode/1up

1995-01 -Satpanth Jyot (107)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.06 16:56:13 +05'30'

Real Patidar
Unravel Truth

realpatidar.com

સતપંથ જ્યોત

વર્ષ : ૨
અંક : ૩
સળંગ અંક : ૧૫

જાન્યુઆરી
૧૯૯૫

: પ્રકાશક :

સતપંથ પ્રકાશન સમિતિ
શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા-૩૮૨૪૨૫
તા. દસક્રોઈ, જિ. અમદાવાદ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk107/page/n3/mode/1up

realpatidar.com

* પ્રાર્થનાનું પ્રમાણ *

શબ્દ જ્યારે પોતાનામાંથી નીકળી આત્મામાં ઉભરાય છે ત્યારે જ તે શક્તિ ધારણ કરે છે, પ્રાર્થનાના શબ્દો આપણા ઉંડાણમાં રહેલ અંતરને અથડાવા જોઇએ. સામાન્ય રીતે આપણે લોકો શબ્દમાં જ જીવીએ છીએ, મોટેથી પ્રાર્થનાઓ બોલીએ છીએ, પરંતુ એ શબ્દોની પાછળ રહેલા વિચારો આપણને સ્પર્શ્યા જ હોતાં નથી. વિચારો એ જ અગત્યની વસ્તુ છે. તે સૂક્ષ્મ હોવાથી સામાન્ય મનુષ્યો તેનું મહત્ત્વ સમજી શકતાં નથી.

વળી પ્રાર્થના પ્રભુની ઇચ્છા પ્રવર્તે એવી કરવાની છે. સર્વત્ર પરમાત્માની ઇચ્છા જ પ્રવર્તે એવી અભિપ્સા સાથે પ્રાર્થના કરવાની છે. 'પુણ્યનો જય થાઓ અને પાપનો ક્ષય થાઓ' એવી પ્રાર્થના ઈશ્વર સદા સાંભળે છે. આપણે આપણા સમગ્ર જીવનને પ્રાર્થનારૂપ બનાવવાનું છે. આપણી જાતને પ્રભુનું મંદિર બનાવવાનું છે અને તેમાં પરમાત્માને બિરાજમાન કરવાના છે.

(સંકલન : ચીમનલાલ એસ. પટેલ તાંદલીયા ખેડબ્રહ્મા)

વાર્ષિક લવાજમ : ભારતમાં રૂા. ૪૨/-	વિદેશમાં : રૂા. ૧૮૫/-
આજીવન ગ્રાહક : ભારતમાં રૂા. ૪૫૧/-	વિદેશમાં : રૂા. ૧૪૦૦/-
અમર ગ્રાહક : ભારતમાં રૂા. ૧૦૦૧/-	વિદેશમાં : રૂા. ૩૦૦૧/-

છુટક નકલ રૂા. ૪/-

• સતપંથ જ્યોત દર મહિનાની દશ તારીખે પ્રગટ થશે. • ગ્રાહકે પોતાના સરનામામાં ફેરફાર કરવાનો હોય તો નીચેના સરનામે પત્રથી જાણ કરશો. • પત્ર વ્યવહાર કરતી વખતે પોતાનો ગ્રાહક નંબર અવશ્ય જણાવશો. • ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે. • પોતાના ગામના અંકોના વિતરણ કાર્યમાં સેવા આપનાર વ્યક્તિએ પોતાનું નામ અને સરનામું જણાવવું.

પત્રવ્યવહાર તથા લવાજમનું સરનામું :-સતપંથ પ્રકાશન સમિતિ
સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ જિ. અમદાવાદ 382425
સંપાદક :- શ્રી સામજીભાઈ કે. પટેલ

મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટીંગ ટાંટા રોડ, અમદાવાદ-૧. ટે. નં. ૩૬૩૬૩૧

realpatidar.com

https://archive.org/details/bk107/page/n4/mode/1up

realpatidar.com

સતપંથ સંપ્રદાયનું ધાર્મિક પ્રેરણા આપતું માસિક

સતપંથ-જ્યોત

[માસિક]

વર્ષ ૨] અંક ૩ * જાન્યુઆરી-૧૯૯૫ * [સળંગ અંક ૧૫

— લેખકોને વિનંતી —

સતપંથ જ્યોત, સતપંથ સંપ્રદાયની માસિક પત્રિકા છે. તેમાં સંપ્રદાયને તથા સર્વ ધર્મને સર્વોપયોગી થાય તેવી મુખ્યત્વે વાર્તા, લેખ, જીવન વૃત્તાંત, કાવ્ય, ભજન વગેરે કૃતિઓ પ્રગટ થાય છે. જે સાદી-સરળ ભાષામાં આલેખાયેલી હોવી જોઈએ.

અન્યત્ર પ્રગટ થઈ ગયેલી કે, કોઈ પત્ર-પત્રિકામાં છપાયેલી કૃતિઓ સ્વીકારવામાં આવશે નહીં.

કૃતિઓ ફુલસ્કેપ કાગળ ઉપર એક જ બાજુએ સારા અક્ષરે લખાયેલી હોવી જોઈએ. લખાણની તમામ જવાબદારી લેખકની રહે છે. પોસ્ટ કાર્ડ કે અંતરદેશીય પત્ર પર લખેલા લેખ રદ બાતલ ગણાશે.

પોતાનો લેખ અંકમાં ફરજિયાત પ્રગટ થાય તેવો આગ્રહ રાખવો નહીં.

સતપંથ જ્યોતમાં પ્રગટ થતા બધા લેખો સાથે સંપાદક હંમેશાં સહમત છે તેમ માનવું નહિ. લેખ પ્રસિદ્ધ કરવો કે નહિ, તે સંપાદકને આધિન છે.

-સંપાદક

સંપાદકીય

પ્રિય વાચક મિત્રો તમો બધા સતપંથ જ્યોત માસિક અંક મંગાવી ઉમંગથી વાંચી પત્ર દ્વારા આપનો પ્રતિસાદ અમારા સુધી પહોંચાડો છો તેનાથી અમારી કામ કરવાની શક્તિ અનેક ઘણી વધી જાય છે. અમોને આશા છે કે આપણું સતપંથ જ્યોત બધા જ ઘરોમાં આવતું હશે જ કદાચ ન મંગાવતા હો તો હવેથી મંગાવી લેશો "સતપંથ જ્યોત"નું ખર્ચ એક માસના ફક્ત રૂા. સાડા ત્રણ જ થાય છે. જે વધારે ન કહેવાય !! ફક્ત સાડા ત્રણ રૂપિયામાં ઘેર બેઠાં આપણું આખું કુટુંબ સંસ્થા સમાચાર તેમજ ધાર્મિક દષ્ટાંતો, કથાઓ, ભજન, કાવ્ય તેમજ સદ્‌ગુરૂશ્રી ઇમામશાહ મહારાજની વાણીનો લાભ મેળવી શકે તો અમારી નમ્ર વિનંતી છે કે "સતપંત જ્યોત"નું લવાજમ ભરી મંગાવી લેશો....

અત્યારે માનવ સમાજ ઉપર નજર ફેરવતાં એવું દષ્ટિપાત થાય છે કે આપણો સમાજ ધીરેધીરે જાગૃત થઈ રહ્યો છે. છતાં આટલેથી સંતોષ માનવાનો નથી. હજી આપણે પૂર્ણ જાગૃત અવસ્થામાં પહોંચવાનું છે. જાગૃતી માટે આડે આવતા અવરોધોને હટાવવા પડશે અવરોધો જેવા કેઃ-

(૧) અંધશ્રદ્ધા દૂર કરી સાચી શ્રદ્ધા લાવવી પડશે.

(૨) આપણે કુસંસ્કારો દૂર કરી સુસંસ્કારોનું સિંચન કરવું પડશે.

(૩) યુવા વર્ગ નિસક્રિય છે તેને સક્રિય કરવાનો છે.

(૪) વી.આઈ.પી. વર્ગ બિલકુલ સુસુપ્ત અવસ્થામાં છે. તેને જાગૃત કરવાનો છે.

[અનુ. પાન નં. ૨ ઉપર]

realpatidar.com

https://archive.org/details/bk107/page/n5/mode/1up

realpatidar.com

(અનુ. પાન ૧ નું આગળ)

(૫) આપણી શિક્ષણ વ્યવસ્થા નબળી છે. તેને મજબુત કરવી પડશે.

(૬) રાજકીય પાસુ નબળુ છે. તેને મજબુત કરવું પડશે.

(૭) ધર્મપ્રચાર નબળો છે. જે વેગવંતો પ્રચાર કરવાનો છે.

- ઉપર જણાવ્યા પ્રમાણે પુર્ણ જાગૃતિ માટે ઘણું જ કરવાનું બાકી છે. તો આવો આપણે અત્યારથી જ એક થઈ પ્રયત્નમાં લાગી જઈએ !!!

□

સૌને અભિનંદન નવા વરસના

પટેલ હસમુખકુમાર સી.
ઇશ્વરપુરાકંપા (S.K.)

સૌને અભિનંદન નવા વરસનાં,
નેત્રે આંસુ છે હર્ષનાં.
સૌને અભિનંદન નવા વરસનાં. ૦

અવિરલ પ્રેમ પ્રવાહ વહેતો રહે,
ભિજાતાં રહે હૈયાં સદા હેતમાં.
સૌને અભિનંદન નવા વરસનાં. ૦

નંદન વન સમ જીવન મહેંકી રહે,
દયા ભાવ રહે એક-મેકમાં.
સૌને અભિનંદન નવા વરસનાં. ૦

નવનિત ઉમંગો ઉરમાં રહે,
ન કોઈ કમી રહે જીવનમાં.
સૌને અભિનંદન નવા વરસનાં.. ૦

વાવા ઝોડાં તુફાન કદાપિ ન રહે,
વસંત ઋતુ રહે પુર બહારમાં.
સૌને અભિનંદન નવા વરસનાં. ૦

રક્ષા લક્ષ્મી-સરસ્વતી તણી રહે,
સન્મુખ રહે ગણેશ સદા સહાયમાં.
સૌને અભિનંદન નવા વરસનાં. ૦

નારાજ "હરિ" આજ કોઇથી નાં રહે,
યાદ સૌની છે આજ અંતઃકરણમાં.
સૌને અભિનંદન નવા વરસનાં. ૦

realpatidar.com

https://archive.org/details/bk107/page/n6/mode/1up

realpatidar.com

❋ મનચિંતામણી પુસ્તકમાંથી ❋

શ્રી ઈમામશાહ મહારાજ રચિત

(ગતાંકથી ચાલુ)

વળી વળી એવે અવસરે જો મલીએ,
હરી સમરતાં સર્વે દુઃખ ટળિએ.....(૧)
હરિ સમરણ તણો એ છે નેમ,
સદ્‌ગુરુ સાથે નિરંતર પ્રેમ....... (૨)
સર્વે સમરણ હરિનું કરીએ,
નિંદા જુઠ મનથી પરહરીએ...... (૩)
મન વચન કર્મ કરી,
સઘળે જાણે એક જ હરિ....... (૪)
સર્વ સૃષ્ટિ શું સરખી પ્રિત,
મુનિવર અમરની સમરણ રીત.... (૫)
તુંહી સાચા સાહેબ હો....
એ જ રીત સમરણ તણી,
નિર્મલ ભક્તિ પ્રમાણ,
અખંડ ધ્યાને આરાધિયે,
તે અનંત ભક્તિ જાણ. (૨૫)
અનન્ય ભક્તિ તેનું નામ,
હરિ વિના નહિ ઠાલો ઠામ....... (૧)
સઘળે જાણો આતમ રામ,
મુનિવર અમર રે તત્ત્વ જ્ઞાન...... (૨)
સબ ઘટ જાણી સર્વને વંદો,
મુનિવર અંત તે કેને નવ નિંદો... (૩)
આત્મ સર્વનો અંતર જામી,
સબઘટ સરખો એક જ સ્વામી.... (૪)
બાહેર ભીતર એક હરિનો વાસ,
સત્ય ગુરુ સર્વ કરે પ્રકાશ....... (૫)
તુંહી સાચા સાહેબ હો....
સર્વને સદ્‌ગુરુ કહે,
તમે ચેતો મુનિવર વીર,
બાહેર ભીતર વશી રહ્યો,
સર્વે નિર્મળ શરીર. (૨૬)

ક્રમશ આવતા અંકે

realpatidar.com

https://archive.org/details/bk107/page/n7/mode/1up

realpatidar.com

❋ શ્રી સદ્‌ગુરૂ ઈમામશાહ મહારાજ જીવન વૃત્તાંત ❋

(ગતાંકથી ચાલુ)

સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે પણ કહ્યું છે કે પરમાત્મા પરમશાંત અને અદ્વૈત છે. અને એને જાણનારા બ્રહ્મ જ થાય છે. માણસે પોતાનું મન શાંત અને એકાગ્ર કરી પરબ્રહ્મનું એટલે જ્યોતિસ્વરૂપનું નિત્ય ધ્યાન ધરવું કે જેથી તેને હજારો સૂર્ય જેવા તેજસ્વી પરમસુખદાયી એવા પરમેશ્વરનું દર્શન થશે. પરમવિશુદ્ધ જ્યોતિમાં તેની આત્મજ્યોત એકરૂપ થઈ માણસ લક્ષચોર્યાંશીના ફેરામાંથી મુક્ત થશે.

આ પ્રમાણે પરમાત્મા સાથે તદ્રુપ થવું એ જીવનનું આદ્યકર્તવ્ય છે. તેની પૂર્તિ માટે શ્રેષ્ઠ શ્રદ્ધા હોવી જોઈએ. સત્યવસ્તુ ઉપરની શ્રદ્ધા શુભ ફળ આપનારી હોય છે. સંસારના નાનામોટા કામોમાં પણ શ્રદ્ધા ઉપર આધાર રાખવો પડે છે, તો પછી પરમાર્થ માર્ગમાં તો શ્રદ્ધા હોવી જરૂરની હોય જ. સદ્‌ગુરૂએ કહ્યું છે કે 'તું આ મંત્રનો જાપ કર એટલે તને ઈશ્વરનો સાક્ષાત્કાર થશે.' આ ગુરુવચન એ ઈશ્વરના વચન સમાન માની પૂર્ણ શ્રદ્ધાથી માણસ ગુરૂએ આપેલા મંત્રનો એક નિષ્ઠાથી જાપ કરશે તો તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થયા વગર નહી રહે. પણ એના વિરૂદ્ધ વર્તન કરી ગુરુવચન ઉપર અશ્રદ્ધા અને શંકા રાખશે તો તે માણસ ગમે તેટલા જાપ કરશે તો તેનું કદાપિ કલ્યાણ થશે નહીં. અશ્રદ્ધા હંમેશાં નડતરકર્તા હોય છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે 'संशयात्मा विनश्यति।' સંશયી માણસ નાશ પામે છે. વિનાકારણ શંકા ઉઠાવનાર માણસ કંઈપણ નિશ્ચય કરી શકતો નથી અને તેથી તેનો નાશ થાય છે. શ્રી ઈમામશાહ મહારાજ કહે છે કે 'શંકા કરશે તે ડૂબશે' તેથી ગુરુવચનમાં અગર બીજા કોઈ કામમાં શ્રદ્ધા નહીં રાખનાર કદાપિ સફળ થતો નથી. તેમજ આલોકમાં પરલોકમાં તેની ઉન્નતિ થતી નથી.

ઈશ પ્રાપ્તિ માટે સૌ પ્રથમ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાથી સત્સંગ અને સત્સંગથી જ્ઞાન મળે છે. જીવ સામેનો સંસારરૂપી પડદો દૂર થાય છે ત્યારે જ તેને પરમસ્વરૂપના પ્રત્યક્ષ દર્શન થાય છે. આ પડદો દૂર કરવા માટે જ્ઞાન જોઈએ. જ્ઞાનથી ભક્તિ ઉત્પન્ન થાય છે, અને ભક્તિના લીધે સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન થવાથી બ્રહ્મ એ જ સત્ય અને બીજું મિથ્યા છે, એનું ભાન થાય છે. આ ભક્તિને જ્ઞાનોત્તર ભક્તિ અથવા અન્યોન્ય ભક્તિ કહે છે. જ્ઞાનના લીધે ભક્તિ અને ભક્તિના લીધે જ્ઞાન હોય છે. જ્ઞાન સિવાયની ભક્તિ સૂકા લાકડા જેવી અને ભક્તિ સિવાયનું જ્ઞાન રસ વગરના ફળ જેવું છે. ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ હોવો જોઇએ, એનું જ નામ ભક્તિ એમ ભક્તિસૂત્રમાં કહ્યું છે. સકામ ભક્તિ કરવા નિષ્કામ ભક્તિ–જ્ઞાન ભક્તિ–અનન્ન ભક્તિ શ્રેષ્ઠ હોય છે. સર્વ કર્મમાં નામસ્મરણ એ જ સૌથી સહેલું કર્મ છે. આ નામસ્મરણની સિદ્ધિ માટે ભક્તિ અને જ્ઞાન એ મુખ્ય સાધનો છે, તેથી સ્થિર નિષ્ઠાથી અને અનન્ય ભાવથી, સંશય નહીં રાખતાં, નામસ્મરણરૂપી તપ આચરવું. ખાતા, પીતા, હરતા, ફરતા, કામ કરતા વગેરે દરેક પ્રસંગે પ્રભુના નામને કદાપિ ભૂલવું ન જોઈએ, બધા કામમાં બીક, શરમ કે શંકા ત્યજી નિર્ભયતા અને નિષ્ઠાથી ઈશ્વરના નામનું રટણ કરવું. શ્રી ઈમામશાહ મહરાજ કહે છે–

realpatidar.com

realpatidar.com

દૂર દેશથી આવ્યો વણઝારો સામલ સુદ સવદા કિજીયે ।
ઉઠતા બેસતા રાહ ચલતા, નામ સ્વામીજીના લિજીએ ॥

ઈશ્વરના નામનું રટણ અને સ્મરણ નિરંતર કરતા રહેવું. સતત અભ્યાસ સિવાય કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઇ શકતી નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે—

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥

गीता अ. ६ श्लोक. ३५

હે અર્જુન, આ મન ખરેખર અતિચંચળ અને ઘણા પ્રયત્ન પછી વશ થનારું છે. પણ સતત અભ્યાસથી અને વિરક્તિથી તે વશ થઈ શકે છે. તેથી સતત અભ્યાસની જરૂર છે. સદ્ગુરુ ઇમામશાહ મહારાજ કહે છે-

હરદમ જપો અજંપા જાપ । જપતા રહિયે જાપ અજંપા ।
મુંડ કમંડલ કાઈ ધર કરી રાખો । નાભી કમલથી જગાવો ॥
સદ્ગુરુ શબ્દના માંહે બાજા બજાઈએ । સુરતિ સુહાગ ચડાઈએ ।
મુખવિના ગાઈએ શ્રવણવિના સુણીએ । બીનકર તાલ બજાઈએ ॥
તાલ પખવાજ મૃદંગ બાજે । બિન રસના ગુણ ગાઈએ ॥

ઈશ્વરનું નામસ્મરણ કરવા માટે સન્યાસીની જેમ મુંડન કરી હાથમાં કમંડલ લઇ વનમાં જવું પડતું નથી. ઘરમાં જ રહી ખરા અંતઃકરણથી અને પુરા ભક્તિભાવથી નામ સ્મરણ કરવું તે માટે વાજું વગાડવાની જરૂર નથી. મુખે ગાવાની, કાને સાંભળવાની અથવા મૃદંગ પખવાજ મંજીરા વગેરે વગાડવાની બીલકુલ જરૂર નથી. સદ્ગુરુ તરફથી મળેલા જાપનું મનમાં હંમેશા સ્મરણ કરતા રહેવું. હરિનામ મંગલનું મંગલ, પાવનનું પાવન, કલ્યાણનું નિધાન અને પાપ હરન કરનારું છે. એના સ્મરણ માત્રથી સર્વદુઃખ અને પાપના ઢગલા દૂર થાય છે. આના ગુણ જેટલા વર્ણવીએ તેટલા થોડા છે. નામસ્મરણ એ ભવરોગ દૂર કરવા માટે રામબાણ ઇલાજ છે. પ્રભુના મંગલ નામનું નિરંતર સ્મરણ કરવાથી સર્વકર્મ સહેલાઈથી સાધ્ય થશે. ભાવસાગર પાર કરી શકશે, મુક્તિ મળશે, સંસારબંધન તૂટશે, પરમાત્માની પ્રાપ્તિ થશે. તેથી આજ સર્વોત્તમ અને સત્ય છે.

ઈશ્વરની ભક્તિ કરતી વખતે મન સ્થિર રાખવું જોઈએ. કારણ મન એ તમામ બાબતોનું મૂળ છે. વિરક્તિ નિર્માણ થાય એટલે મોહ એની મેળે જ દૂર થાય છે. પણ વિરક્તિ માટે સદ્ગુરૂએ આપેલા ઉપદેશનું સ્મરણ કરતા રહેવું કે જેથી ચિત્ત શુદ્ધ થઈ મન શાંત થવા લાગશે. ઈશ્વરની ભકિત માટે શાંત અને એકાંત વાતાવરણની જરૂર હોય છે. તેથી જ સદ્ગુરુ ઇમાશાહ મહારાજે ઘટપાટ પૂજા કરવાનો નિયમ કર્યો છે. આ પૂજા સનાતન વૈદિક ધર્મવિધિ મુજબ કરવામાં આવે છે અને તેના બધા મંત્ર કલિયુગમાં પ્રમુખ અને બ્રહ્મવિદ્યામાં શ્રેષ્ઠ એવા અથર્વવેદ મુજબ બોલવામાં આવે છે.

(ક્રમશઃ આવતા અંકે)

realpatidar.com

https://archive.org/details/bk107/page/n9/mode/1up

realpatidar.com

સુરતમાં સતપંથી વાયરો

ભીખુભાઈ પટેલ
પત્રકાર : જેતલપુર
તા. દસક્રોઈ જિ. અમદાવાદ

સત્પંથ સંપ્રદાય તેની ક્ષિતિજો વિસ્તારી રહ્યો છે. તેનો ઉજાશ ધીરેધીરે ભારત વર્ષના ખૂણે ખૂણે પથરાઈ રહ્યા છે. ભારતની ચાર મુખ્ય શક્તિ પીઠોમાં પ્રેરણાપીઠ પીરાણા ગણનાપાત્ર બની ગઇ છે તેનો આનંદ દરેક સત્પંથીના હૈયામાં વર્તાઈ રહ્યો છે. સતપંથ સંસ્કૃતિનું અને ભારતીય પરંપરાનું જતન કરનારા સુફી સંત અને સદ્ગોર શ્રી ઈમામશાહ મહારાજના ઉપદેશાત્મક અને પાવનકારી પગલાંએ આર્યવત્માં જે જે સ્થળોએ પરિભ્રમણ કર્યું છે તે પૂણ્યશાળી ભૂમિ બની ગઇ છે. સદ્ગોર શ્રી ઈમામશાહ મહારાજના પવિત્ર ચરણોથી પ્રત્યેક રજકણ પવિત્ર બની છે એવી દક્ષિણ ગુજરાતની સુરત નગરીમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના અવતારનો શંખ ફુંકાઇ રહ્યો છે. જેનું ગુંજન પ્રત્યેક ભાગ્યશાળી સત્પંથી સ્વજનના કાનમાં થઇ રહ્યું છે.

ચાલો આપણે સૌ સુરતના સત્પંથી વાયરાની મસ્તીમાં ઝુમી લઈએ. અને ભગવાન નિષ્કલંકી નારાયણને વંદના કરી લઇએ જ્યોતિર્મય અને સદ્ગોર શ્રી ઈમામશાહ મહારાજની કલા જેમાં ઉતરી છે તેવા પૂજ્યપાદ આચાર્યશ્રી કરસનદાસજી મહારાજના સુરત પ્રવાસમાં જોડાવવાનો લ્હાવો મને મળ્યો. સત્પંથી રંગની ભીની ચુંનરીયાએ મને તેના રંગમાં રંગી દીધો. સત્પંથી બની શકું તેટલી કક્ષા મારામાં નથી. કેટલીક અધુરપ છે છતાં સદ્ગોર શ્રી ઇમામશાહ મહારાજ અને પરમ વંદનીય આચાર્યશ્રી કરસનદાસજી મહારાજની (પૂ. દાદાજી) કૃપા અને પ્રેમ તો મેં પ્રાપ્ત કર્યા છે.

પૂજ્ય આચાર્યશ્રીની આજ્ઞાથી અને વડીલ સત્પંથીઓ મુ. શ્રી શ્યામજીભાઇ તથા મુ.શ્રી દેવરામભાઇ મુ.શ્રી. ભીમજીભાઇ વિગેરેના આગ્રહને સન્માન આપી હું સુરત જવા માટે આચાર્યશ્રીની સાથે ગોઠવાયો. સાંજના પાંચના સુમારે અરબી તટના ડુમસ મુકામે આવેલી બાપુજીની વાડીમાં મુકામે પહોંચ્યા. ડુમસ તથા આ વિસ્તાર ચોર્યાસી તાલુકો મારાથી પરિચિત હતો પરંતુ બાપુજીની વાડીની મુલાકાત પ્રથમ હતી.

આજે આખો અરબી કિનારો સત્પંથી સુવાસથી મ્હેંકી રહ્યો છે. પ્રકૃતિમય રૌમ્ય શાંત વનરાજી, ઘટાદાર લચીલા વૃક્ષો, ગ્રામીણ ભાતીગળ લોક જીવનને ધબકતું જોયું. અહિંયા પરંપરાગત સંસ્કૃતિના વારસાનું જતન થઈ રહ્યું છે. સત્પથી સ્વજન આત્મીય બંધુશ્રી મોહનભાઇ ચીમનભાઇ પટેલની ઓળખ તેમની વાડીએ કરાવી દીધી. મારા શબ્દોમાં કહું તો હું એક સત્પંથ બાગમાં આવી ચડયો છું. જ્યાં સતત શ્રા નિષ્કલંકી નારાયણની જય હો નો નાદ ગુંજી રહ્યો છે, પ્રભુના ગુણગાન થઈ રહ્યા છે. શ્રી મોહનભાઇની લાગણી સભર સ્વાગતની પ્રણાલિએ પ્રભાવિત થયો. આવી નયનરમ્ય વાડીમાં લાવીને જે મને આ સંસ્કારના દર્શન કરાવ્યા તે બદલ પૂજ્યપાદ આચાર્યશ્રીનો ઋણી બની ગયો છું.

સુરત નગરી સોનાની સુરત છે. સુરત માટે ભારત ભરમાં એક કહેવત ખૂબ પ્રચલિત બની છે. "સુરતનું જમણ અને કાશીનું મરણ" આજે આ નગરીએ સાર્થક કરી બતાવી છે. અમારી મહેમાનગતિ પણ સુરત નગરીની જ છે તા. ૧૭-૧૮ ડીસેમ્બર-૯૪ સુરત માટે પહેલેથી જ આરક્ષીત હતી.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n10/mode/1up

realpatidar.com

રાણીશેરી બેગમપુરા ખાતે આવેલા શ્રી બોડામુખી સતપંથી મંદિરનું કલેવર બદલાયું. તેમાં પ્રેરણાપીઠ પીરાણાના જ્યોતિર્મય આચાર્યશ્રી કરસનદાસજીએ પોતાના સ્વહસ્તે વૈદિક પરંપરા મુજબ જ્યોત પ્રગટાવીને સમગ્ર મંદિરને ચેતનવંતુ બનાવી દીધું. મંદિરને સાચવનારા મુખીઓ પ્રસ્થાપિત કર્યા. લોકો ઘેલા બનીને નાચી ઊઠયા. આખી શેરીમાં બસ શ્રી નિષ્કલંકી નારાયણની જય જય થવા લાગી.

સુરત નગરીના નસીબે પવિત્ર તાપીમાતા વહી રહ્યા છે. આ તાપીને કિનારે આદ્યશક્તિ જગતજનની શ્રી જગદંબાનું અંબિકા નિકેતન ધામ આવેલું છે. અડવા ગામના ભાવિક સતપંથી સ્વજનોએ સુંદર અને ભવ્ય શ્રી નિષ્કલંકી નારાયણના મંદિરનું નિર્માણ શ્રી જગદંબા માતાની બાજુમાં કર્યું છે. તેમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ તા. ૧૮-૧૨-૯૪ના રોજ રવિવારે અડવા (સુરત) ખાતે ઉજવાયો.

પૂજ્યપાદ આચાર્યશ્રી કરસનદાસજી મહારાજની સાથે પૂજ્યશ્રી જગન્નાથજી મહારાજ ફૈજપુર, પૂજ્યશ્રી શંભુરામજી મહારાજ, પૂજ્યશ્રી સવગણદાસજી મહારાજ કુકસ, પૂજ્ય સ્વામીજી મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી મહારાજ દિયોલી આશ્રમની સાથે અન્ય સંતો આ શુભ કાર્યમાં જોડાયા અને દરેકને કલ્યાણકારી આશીર્વાદ આપ્યા.

અડવા ખાતે ભગવાનશ્રી નિષ્કલંકી નારાયણ ભવનમાં મહાપ્રભુજીના સિંહાસન, બ્રહ્માજીના ઘટપાટ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આદ્યશક્તિની જ્યોતનું પ્રાગટ્ય થયું. અથર્વવેદીય શ્રી નિષ્કલંકી નારાયણનો મહાયજ્ઞ પરિપૂર્ણ થયો. ભવનના ઉપલા માળે સુંદર મઝાનું શ્રીમતી મણીબેન રમણલાલ ટેલર "સત્સંગ ભવન" નું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર–સાથે સત્સંગ ભવન કેવા સંજોગ બન્નેનુ નિર્માણ ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના અવતરણનો સંકેત સતપંથીઓને પૂરો પાડે છે અને ભગવાનના આગમન માટે તૈયાર કરે છે.

સુરતની જનતા પાવન બનશે ઘેર ઘેર શ્રી નિષ્કલંકી નારાયણ નમઃના જપ જપાશે. સતપંથી ગુંજન થશે. આ સુંદર પ્રભુના આવાસમાં જે કોઈ નામી/અનામી સતપંથીઓએ નાનો/મોટો સહયોગ આપીને પોતાનો સુર પૂરાવ્યો છે. તેની નોંધ સદ્ગોર શ્રી ઈમામશાહ મહારાજના પ્રતિનિધિ આચાર્યશ્રી કરસનદાસજી મહારાજે લીધી છે. આચાર્યશ્રીએ સતપંથીઓને રક્ષણાત્મક, વિકાસાત્મક ભરપૂર આશીર્વાદ આપ્યા છે. સુરતમાં પાંચ મંદિરો સતપંથી સંપ્રદાયના સાક્ષી બન્યા છે. તે જાણી ખૂબ જ આનંદ થયો.

અડવા સતપંથી સ્વજનોના ભાવભીનાં આમંત્રણને માન આપીને અને પૂજ્યવાદ આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ અને સતપંથી સંતોના દર્શન કરવા માટે અડવા ખાતે મુંબઈ, નાસિક, વલસાડ, અમદાવાદ, વડોદરા, કચ્છ, સાબરકાંઠાથી સતપંથીઓ પધાર્યાં હતાં. એક વાત મારા હૈયામાં સ્પષ્ટપણે અંકિત થઈ ગઈ છે. તે કદિ ભૂંસાશે નહિ. કલિયુગના અંતે આ દેવભુમિમાં જે કંઇ નવપલ્લન (નિર્માણ) થશે તેનો યશ સતપંથ સંપ્રદાય અને સમાજને ફાળે જશે તેમાં લેશમાત્ર શંકા નથી. જગદ્ગુરુ સહિત ભારતભરના તમામ સંતો, મહંતો, મહામંડલેશ્વરોએ પ્રેરણાપીઠ પીરાણાના આચાર્યશ્રી કરસનદાસજી મહારાજને નવાજી મોટા આશીર્વાદ આપ્યા છે અને સદ્ગોર શ્રી ઈમામશાહ મહારાજની કળામાં વિશ્વાસ મૂકયો છે. છસો વર્ષની અખંડ જ્યોત ભગવાનના આગમનની પ્રતિક્ષા કરી રહી છે

જયશ્રી નિષ્કલંકી નારાયણ નમઃ ।

realpatidar.com

https://archive.org/details/bk107/page/n11/mode/1up

realpatidar.com

જીવનનું પરિવર્તન

—કુ. ઉષા આર. પટેલ
મેઘપુરા (બાયડ)

જે માણસ ધર્મી બનવા માંગતો હોય એની પાસે ધર્મના સદ્‌ગુણોની મૂડી હોવી જરૂરી છે. આપણી પાસે ગુણ હોય અને ખ્યાતિ પામીએ તો જાણે ઠીક છે, બાકી બાહ્ય આડમ્બર નકામા છે. આ દુનિયામાં સફળતાની સીડી ચડવા માટે સદ્‌ગુણો કેળવવા આવશ્યક છે. આવા સદ્‌ગુણોથી જ જીવનમાં સાર્થકતા લાવી શકાય.

આપણી આ કાયા તો માટીનું પૂતળું છે, એમાં રહેલા સદ્‌ગુણો એ જીવનનું સોનું છે. આપણે આ સદ્‌ગુણો કેળવીએ તો માનવમાંથી દેવ થઈ શકાય. આપણું જીવન એટલે ધર્મરૂપી આ અમૂલ્ય હીરો છે. પણ આજે આપણે એને કાચ બરાબર સમજીને વાપરી રહ્યા છીએ. આ સંસારનો ભૌતિક ખજાનો છેવટે નકામો છે. એ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. પણ આપણી અંદર એક બીજો સાચો ખજાનો છે તેને જ્ઞાન અને પરમાત્માના નામની જ્યોતથી આપણે એને જોવાનો છે. આજે પરમાત્માની આ જ્યોત આપણી પાસે જલતી નથી, તેથી જીવન અંધકારમય લાગે છે, પણ જ્યારે અંદરની એ જ્યોત પ્રગટશે ત્યારે આ લોક અને પરલોક બેઉના જીવન ઉપર નવો પ્રકાશ ફેલાશે.

આ સફળતા મેળવવા માટે ગંભીરતા, વિકારોનો ત્યાગ, તંદુરસ્ત જીવન, રાગદ્વેષથી પર અને સ્વભાવની નિર્મળતા વગેરે ગુણો આપણામાં હોવા આવશ્યક છે. મનુષ્ય આત્માને સમજવા માંડે છે ત્યારે એના સ્વભાવમાં ધીમે ધીમે પરિવર્તન થાય છે. અને સાચા આનંદને પામે છે.

□

બિરદાવો

કુ. લીના એમ. પટેલ
માળકંપા (મોડાસા)

કોઈ વ્યક્તિ નાની સરખી પણ સફળતા મેળવે તો તેને શાબાશી આપો, પીઠ થાબડો, ખભા ઉપર હાથ મુકો, ધન્યવાદ પાઠવો તમે સૌના વહાલા પ્રેરક બળ બની જશો.

બાળકનેય ધન્યવાદ આપતા ખચકાશો નહી તેની પા-પા પગલીમાં વિરાટ પગલાંની સંભાવના છે તમે તેના પ્રેરણાદાતા બની શકો. આજનું બાળક એ કાલનુ વિશ્વ છે. બાળકનેય ધન્યતાનો એહસાસ થાય છે.

પત્નીને પણ તેની સફળતા માટે ધન્યવાદ આપો સારી રસોઈ થઈ હોય, તેણીની સારો વ્યવહાર કરતી હોય, કાળજીપૂર્વક કામ કર્યું હોય તો તેની પ્રશંસા કરો, સ્મિત આપો નોકરનેય વહાલપુર્વક તેના કાર્યની પ્રશંસા કરી તેને પ્રોત્સાહીત કરો સૌને સંતોષ મળશે. વળતર મળ્યાનો આનંદ થશે તે તમારા સુધી પહોંચશે અને તમે તેના સુધી.

કોઈનાય કાર્યને બિરદાવો, આવડતને અભીનંદો સફળતાને સ્વીકારો અને શુભકામના પ્રગટ કરો. ઉદારદીલ બનીને તેની કદર કરો માણસને જંખના હોય છે કે કોઈ તેના કાર્યને આવડતને ચીજવસ્તુને બિરદાવે આ બહુ મહત્વનું કામ છે.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n12/mode/1up

realpatidar.com

સંપ્રદાયી સંસ્થા સમાચાર :—

ૐ આમંત્રણ પત્રિકા ૐ

શ્રી નિષ્કલંકી નારાયણ સતપંથ જ્યોતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ
ઈશ્વરપુરા, તા. ઈડર

સહર્ષ જણાવતાં અતિ આનંદ થાય છે કે આપણા ઇષ્ટદેવની અસીમ કૃપાથી અમારા ઇશ્વરપુરા ગામમાં નવીન બંધાયેલ ભવ્ય મંદિરમાં વેદમંત્ર ઓમકાર તથા ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના સિંહાસન અને બ્રહ્માજીના ઘટ-પાટ, ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આદ્યશક્તિની જ્યોતિ પ્રાગટ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તેમજ (કુંભ) કળશ વારિયન્ન મહાપૂજા **પ. પૂ. વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ** (ગાદીપતિ, શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા, સંરક્ષક, અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશ) ના વરદ્ હસ્તે **સંવત ૨૦૫૧ ના મહા સુદ-૧૪ ને મંગળવાર તા. ૧૪-૨-૯૫ ના શુભદિને નિર્ધારેલ છે,** તો આ પુનિત ધર્મ કાર્યને આપ સૌ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને આપણું સમજીને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અમારૂં હાર્દિક આમંત્રણ છે. ભક્તિરસના પ્રેમપિયુષના પ્યાલા પીશો અને પાશો એજ આશા સહ...

❋ મંગલ કાર્યક્રમ ❋

— તા. ૧૩-૨-૯૫, સોમવારના શુભ દિને —

(૧) બપોરના ૧-૧૫ કલાકે સાધુ-સંતો તથા મહેમાનોનું સ્વાગત તથા સમૈયું.
(૨) બપોરના ૨-૦૦ કલાકે સાધુ-સંતો તથા મહેમાનોનું સ્વાગત, ફુલહાર વાસ્તવિક વાણીથી આવકારવામાં આવશે.
(૩) બપોરના ૨-૪૫ કલાકે સંતો તથા આચાર્યોના ધાર્મિક પ્રવચન, આશીર્વચન અને મિલન વિધિ.
(૪) સાંજના ૫-૦૦ કલાકે બ્રહ્મ-ભોજન.
(૫) સાંજના ૭-૦૦ કલાકે સંધ્યા આરતી.
(૬) રાત્રે ૮-૦૦ કલાકે સંતવાણી, ધાર્મિક પ્રવચન તથા ભજન કીર્તન.

— તા. ૧૪-૨-૯૫, મંગળવારના શુભ દિને —

(૧) સવારના ૬-૦૦ કલાકે રત્નકણિકા, પ્રભાત સતસંગ.
(૨) સવારના ७-૦૦ કલાકે મંદિરની રૂપરેખાનું પ્રાસંગિક પ્રવચન તથા દાન-ભેટ અને દેવ સ્થાપનાના ચઢાવાનો સ્વીકાર કરવામાં આવશે.
(૩) સવારના ૯-૦૦ કલાકે દેવ સ્થાપના વિધિ મહોત્સવની ધામધુમથી વાજતે ગાજતે તૈયારી થશે.

3

realpatidar.com

https://archive.org/details/bk107/page/n13/mode/1up

realpatidar.com

(૪) સવારના ૧૦-૦૦ કલાકે વેદમંત્ર ઓમકાર તેમજ આદ્યશક્તિ માતાની જ્યોત તથા બ્રહ્મા-વિષ્ણુ-મહેશની જ્યોતિ પ્રાગટ્ય, પાટ સ્થાપના તથા શ્રી નિષ્કલંકી નારાયણના સિંહાસનની સ્થાપના તથા યજ્ઞ કુંભ પુજા પ. પૂ. આચાર્યશ્રી કરસનદાસજી મહારાજના મુખે વૈદિક ઉચ્ચારથી કરવામાં આવશે. વ્યાસપીઠ પર આચાર્યશ્રી સવગણદાસજી મહારાજ (શ્રી નાપાકાકા સતપંથ મંદિર, કુકસ-વડોદરા) બિરાજશે.

(૫) સવારના ૧૧-૩૦ કલાકે બ્રહ્મભોજન બાદ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.

નોંધ—ઉપરોકત કાર્યક્રમનું સંચાલન શ્રી જેઠાભાઈ કે. પટેલ
(આચાર્યશ્રી, જ્યોતિ હાઈસ્કુલ, ખેડબ્રહ્મા) સંભાળશે.

શુભ સ્થળ : મુ. ઇશ્વરપુરા, પો. પ્રતાપગઢ તા. ઇડર (સા. કાં.) ૩૮૩૪૪૦

પત્ર વ્યવહારનું સરનામું : શ્રી જયંતિલાલ સવજીભાઈ પટેલ
મુ. ઇશ્વરપુરા, પો. પ્રતાપગઢ, તા. ઇડર
ફોન નં. STD 02778-6-601/.

નોંધ : ઇડરથી વિજયનગર જતી તમામ બસ તથા જીપોમાં પ્રતાપગઢ પાટીયે ઉતરવું. ત્યાંથી ઇશ્વરપુરા જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇશ્વરપુરા આવવા માટે બસના સમય-	ઇડરથી ઉપડશે	ઇશ્વરપુરા પહોંચશે
ઇડરથી ઇશ્વરપુરા વાયા કડીયાદરા-ચોરીવાડ	૭-૪૫ સવારે	૮-૪૫ સવારે
ઇડરથી ઇશ્વરપુરા વાયા બડોલી-રેવાસ-મુટેડી	૯-૦૦ સવારે	૧૦-૦૦ સવારે
ઇડરથી પંચવટી વાયા કડીયાદરા-ચોરીવાડ	૪-૩૦ સાંજે	૫-૩૦ સાંજે
ઇડરથી ઇશ્વરપુરા વાયા કડીયાદરા-ચોરીવાડ	૭-૧૦ સાંજે	૮-૧૦ રાત્રે

ADVERTISEMENT

The complete vacation in the Pennsylvania Dutch country-U. S. A.

* Eclno Lodge North/South on U. S. Hwy 30, East, Lancaster, PA/7602, Call for reservation 011-717-299-6900 Or 001-717-397-1900
* Days Inn East on RTE 896 North, Ronks, PA 17572, Call for reservation 011-717-390-1800.
* Knights Inn on RTE 13 South, New Castle, DE 19720, Call for reservation 001-302-328-6691.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n14/mode/1up

realpatidar.com

✻ કૃપા હોય જો ગુરૂદેવની.....! !! ✻

(બનેલી સત્ય ઘટનાઓ)

સતપંથ સંપ્રદાયના આદ્યગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ તત્ત્વજ્ઞાની અને સાથો સાથ મહાન તેજસ્વી સુફીસંત હતા. તેઓએ મેળવેલી યોગ્યસિદ્ધિ અને બ્રહ્મજ્ઞાન લોક કલ્યાણ અર્થે અતિ મહત્ત્વના હતા. જે તેમના સેવકોના સુખદુ:ખમાં સહભાગી બની શ્રદ્ધા અને સુખના પૂરક બની રહ્યા.

આજે પણ સદ્દગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ ઉપર શ્રદ્ધા રાખનાર અનેક નર-નારી અબાલ વૃદ્ધ કદી નિરાશ થતાં નથી, તેમની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. તેમના પરચા કે જે સત્ય ઘટના બની છે તેમાંના કેટલાક પરચાઓ અમો આ અંકમાં રજૂ કરતાં હર્ષ અનુભવીએ છીએ :-

બાબો બોલતો થવાનો પરચો.

મારો પુત્ર નામે મયંકનો જન્મ થયે ખાસ્સો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાંય બાબો બિલકુલ બોલતો ન હતો. સાધારણ રીતે બાળક માટે અંગ્રેજીમાં કહેવાય છે કે "વન ટુ વોક ટુ ટુ ટોક" એટલે કે બાળક વર્ષે ચાલતું થાય છે અને બે વર્ષે બોલતું થાય છે. આ નિયમ મારા પુત્ર માટે ન જળવાતાં અમો ઘરનાં સૌ ચિંતાતુર થવા લાગ્યાં. આ મુશ્કેલી માંથી માર્ગ કાઢવા માટે સારાયે વિસ્તારમાં ધર્મની મીઠી વાવડી સમાન, માર્ગ ભુલેલા ને દિવા-દાંડી સમાન ગણાતાં પુ. માતુશ્રી વાલુમાની મઢુલી (અમરગઢ S. K.) પહોંચી દુ:ખની રજુઆત કરી તેમણે સદ્દગુરૂશ્રી ઇમામશાહ મહારાજની પ્રેરણાથી અમોને આશ્વાસન આપી અને નિયમિત સદ્દગુરૂશ્રીનું સ્મરણ કરવા જણાવ્યું અને સાથે કહ્યું કે તમો મનથી કંઇક બાધા પણ રાખીલો અમોએ ત્યાં જ મનોમન બાધા રાખી કે જો બાબો બરાબર બોલતો થઈ જશે તો બાબાને સદ્દગુરૂશ્રી ને ચરણે પગે લગાડીશું, યથા શક્તિ ભેટ ધરીશું અને બાબાને સાકર ભારોભાર તોળીશું! ઉપર મુજબની શ્રદ્ધા પૂર્વક માનતા રાખતા ટુંક સમયમાંજ સદ્દગુરૂશ્રીની અમારા ઉપર મહેર થઈ બાબો સરસ રીતે બોલતો થઈ ગયો ઘરનાં સૌ હર્ષ ઘેલાં બની માતુશ્રી વાલુમા તથા સદ્દગુરૂશ્રીનો પાડ માનવા લાગ્યાં. જે નિમિતે આજરોજ તા. ૩૦-૧૧-૯૪ ના દિવસે અત્રે આવી માનેલ માનતા પૂર્ણ કરી ઋણ મુક્ત થયાં છીએ માતુશ્રી વાલુમા તથા સદ્દગુરૂશ્રીને કોટી કોટી વંદન!

ડો. કીરીટ આર. પટેલ ધનસુરા S. K.

ડુબેલ નાણું પરત મળ્યાનો પરચો.

હું અમદાવાદ ખાતે રહી કાપડનો હોલસેલ વેપાર ભારત ભરના પ્રાંતોમાં કરૂ છું. સદ્દગુરૂશ્રીની અસિમ કૃપાથી કોઈ વાતે તકલીફ નહતી. તેવામાં મને દિલ્હી ખાતેનો મોટો

realpatidar.com

https://archive.org/details/bk107/page/n15/mode/1up

realpatidar.com

ઓર્ડર મળ્યો. ઓર્ડર પ્રમાણે મેં કાપડનો જથ્થો રવાના કર્યો સામાન્ય રીતે મહીને પેમેન્ટ મળી જતુ હોય છે. પણ આ સોદામાં મહીના કરતાંય કયાંય મુદત વિતી ગઈ તો પણ દિલ્હીનો વેપારી પેમેન્ટ આપવાનું નામ જ નોતો લેતો હું તો બધી રીતે સંકટમાં આવી પડયો મારે ચારે બાજુથી નાણાં ભીડ થવા લાગી કોઈ રસ્તો સુઝતો નહતો.

તેવામાં દુઃખીયાં ને સુખના કીનારે લઈ જનાર સદગુરૂ શ્રી ઈમામશાહ મહારાજને યાદ કર્યા અને મનોમન અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી કે હે સદગુરૂશ્રી આમાંથી આપ કંઈક રસ્તો કાઢી મને સંકટમાંથી ઉગારી લેજો....જો આમાંથી હું બહાર આવીશ અને મને આ ડુબેલ વસુલાત પાછી મળશે તો મળેલ રકમમાંથી ૨॥ ટકા રકમ હું સંસ્થામાં જનકલ્યાણ અર્થે ભેટ ધરીશ. આવી પ્રતિજ્ઞા લીધા બાદ ફક્ત એકજ માસમાં દિલ્હીના વેપારી ને સદબુદ્ધિ સુઝી મને નાણા આપવાની શરૂઆત કરી દીધી જેમાંથી માનેલ સંકલ્પ પ્રમાણે બાધા ઉતારી ભેટ ધરી ઋણ મુક્ત થયો છે. જેમ જેમ બાકીનાં નાણાં આવતાં જશે તેમ તેમ સંકલ્પ પ્રમાણે નાણાં ભેટ ધરતો રહીશ સદગુરૂશ્રીને મારા કોટી કોટી વંદન.

બખ્તાવરમલ પ્રતાપમલ બાલર અમદાવાદ.

શારીરીક દુઃખ દૂર થયાનો પરચો.

આજથી ત્રણ વર્ષ અગાઉથી મારા મોટા ભાઈશ્રી ગંગારામ ભાઈ ઉ. વર્ષ ૨૮ ને મગજની અસ્થિરતા થવાથી ઘરનાં સૌ ચિંતાતૂર થઈ મોડાસા દવાખાને દાખલ કર્યા, સારવાર દરમ્યાન થોડીક રાહત રહેતી હતી ઘેર આવ્યા બાદ પાછી એજ તકલીફ શરૂ થઈ જતી હતી આવો ક્રમ ત્રણેક વાર ચાલુ રહ્યો, બાદ એક દિવસ એકાતમાં સસદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ યાદ કરી પ્રાર્થના કરી કે જો મોટાભાઈની તબિયત સુધરી જશે તો અમો ઘરનાં સૌ સદગુરૂશ્રી ઈ. મ. ની સમાધિએ દર્શને જઈશુ, પાંચ થાળ પ્રસાદની પુજા ભરાવીશું, મોટાભાઈને સાકર ભારોભાર તોળીશું. યથા શક્તિ ભેટ ધરીશું. ! સાચે જ સદગુરૂશ્રીની અમારા ઉપર અસિમ કૃપા થઈ ભાઇની તબિયત એકદમ સુધરી ગઈ ઘરમાં સૌ આશ્ચર્ય સાથે આનંદવિભોર બની, સદગુરૂનો ઉપકાર માનવા લાગ્યાં જે નિમિતે આજરોજના ૨૩-૧૦-૯૪ ના રોજ રૂબરૂ આવી બાધા ઉતારી ઋણમુક્ત થયો છું. સદગુરૂશ્રીને અમારા સૌના કોટી કોટી દંડવત પ્રણામ.

મહેન્દ્ર ર. પટેલ નહેરૂકંપા (મોડાસા)

અકસ્માતમાં અદભુત બચાવ થયાનો પરચો.

હું ગત તા. ૨૬-૯-૯૪ ના રોજ સામાજીક કામ પતાવો ખેડબ્રહ્માથી મારે ગામ નહેરૂકંપા આવવા મારી ધર્મ પત્નિ સાથે સુઝુકી મોટર સાયકલ ઉપર નીકળેલ ત્યાં રસ્તામાં હીંમતનગર પોસ્ટ ઓફીસ સામે એક બસ ઉભી હતી જેમાંથી મુસાફરો ઉતારતા હતા અમારી મોટર સાયકલ ઉભેલી બસ ને ઓવરટેક કરી આગળ નીકળવાની તૈયારી કરતી હતી ત્યાં પાછળથી બીજી એકસપ્રેસ બસ પુરઝડપે આવી મારી મોટર સાયકલને જોરદાર ટક્કર મારતાં મોટર સાયકલ ઉભેલી બસના પાછલા વિલ સાથે અથડાઈ તેના કુરચા ઉડી ગયા અમો બંન્ને જણા ઉભેલી બસ નીચે ઘુસી ગયાં જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે મારા મોમાંમાંથી જય ગુરૂદેવ શબ્દો સરી પડયા !!! તે સાથે જ સદગુરૂશ્રી ઈમામશાહ મહારાજ સાક્ષાત મને બચાવવા દોડી આવ્યા હોય

realpatidar.com

https://archive.org/details/bk107/page/n16/mode/1up

realpatidar.com

તેવો આભાસ થયો અને અમારા બેમાંથી કોઇને સહેજ પણ ઇજા ન થઈ અમો બંને આબાદ બચી ગયાં ખરેખર તે સદગુરૂશ્રી ની અસિમ કૃપા થઈ જ બન્યું છે. ઉપરોક્ત સત્ય ઘટના આજરોજ તા. ૨૩-૧૦-૯૪ ના રોજ અમે રજુ કરતાં હૈયું ભરાઈ આવે છે.

અરજણભાઇ ક. પટેલ નહેરૂકંપા (મોડાસા)

પુત્ર રત્ન પાપ્તિનો પરચો.

મારે ત્યાં ક્રમાનુસાર ત્રણ બેબીનો જન્મ થયેલ ત્યાર બાદ હું તથા ઘરનાં બધાં એવી ઇચ્છા રાખતાં હતાં કે આ ત્રણે બહેનોને વીર પસલી પુરી પાડનાર ભાઈ આવે તો કેવું રૂડુ! આ માટે અમોએ સદગુરૂશ્રી ઇમામશાહ મહારાજને યાદ કરી મનોમન પ્રાર્થના કરી કે ઉપરના કામમાં આપ સહભાગી થઇ અમારી આશા-અપેક્ષા પુરી કરશો! અને જો આ શક્ય બનશે તો બાબાને પગે લગાડી યથા શક્તિ ભેટ ધરીશું, બાબાની બાબરી ગુરૂદ્વારે ઉતરાવીશું, બાબાને ગોળ ભારોભાર તોળીશું! અને સાચે સદગુરૂ અમારા દુઃખમાં ભાગીદાર બન્યા અમારે ત્યાં ઇચ્છાનુસાર પુત્ર રત્નનો જન્મ થયો ઘરમાં અને ગામમાં, બધેજ આનંદ વિભોર બની સદગુરૂશ્રીનો પાડ માનવા લાગ્યાં જે નિર્મિત આજરોજ તા. ૧૦-૧૧-૯૪ ના રોજ અમે રૂબરૂ આવી માનેલ માનતા પૂર્ણ કરી ઋણ મુક્ત થયાં છીએ સદગુરૂશ્રીને અમારા સૌના અગણિત વંદન!

પ્રદિપકુમાર સી. કાછીયા ધોળકા

શારીરીક તકલીફ દૂર થયાનો પરચો.

હું વર્ષોથી અમદાવાદ મણીનગર ખાતે રહી નિવૃત જીવન ગાળું છું. મને પગે વાની ખુબ જ તકલીફ હતી ચલાતુ પણ નહોતું ત્યારે મેં ડોકટરની એલોપેથી ગોળી લીધી ગોળી લેતાં જોરદાર રીએકશન આવ્યું દર્દ ઘટવાને બદલે ઉલમાંથી ચુલમાં પડયા જેવું થયું અસહ્ય દુઃખાવો થવાથી સદગુરૂશ્રી ઇમામશાહ મહારાજને મનોમન પ્રાર્થના કરી દુઃખ નિવારવા વિનંતી કરી! દુઃખીયાંનાં તારણહારે મારી પ્રાર્થના સાંભળી દવાનું રીએકશન બિલકુલ ઓછુ થઈ ગયું સાથો સાથ વાની તકલીફ પણ મટી ગઈ આજે હું સરસ રીતે ચાલી શકું છું. કોઈ શારીરીક તકલીફ રહી નથી. જે આજરોજ તા. ૨૨-૧૨-૯૪ ના દિને અત્રે આવી યથા શક્તિ ભેટ ધરી ઋણ મુક્ત થઈ છું. સદગુરૂશ્રીને મારા અંતર શ્રી કોટી કોટી વંદન.

શાંતાબેન એન. પટેલ મણીનગર અમદાવાદ.

નોકરી મળ્યાનો પરચો.

આજે શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન સમગ્ર દેશ ઉપર છે. જેમાંથી હું પણ બાકાત ન હતો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ હોવાથી નોકરી માટે પ્રયત્ન ચાલુ જ રાખ્યા હતા. મારા જેવા માટે અંગ્રેજીમાં કહેવાય છે કે Apply, Apply, Apply, But No Reply તે પ્રમાણે

૪

realpatidar.com

https://archive.org/details/bk107/page/n17/mode/1up

realpatidar.com

ક્યાંય નોકરી અંગે મેળ પડતો નહતો. તેવામાં મારા ગામ નજીક જ સદ્દગુરૂશ્રી ઇમામશાહ મહારાજ ના સમાધ સ્થળે જઈ અંતરથી મુશ્કેલીની રજુઆત કરી કે મને યોગ્ય નોકરી મળશે તો મારી સરવીસ ના પ્રથમ પગારની અડધી રકમ આપના ચરણે મુકીશ અને દર્શને આવીશ! ટુંક સમયમાં સદ્દગુરૂશ્રીની મારા ઉપર અનહદ કૃપા થઈ મને સરકારી આબકારી ખાતામાંથી નોકરીનો ઓર્ડર મળી ગયો હું સરવીસમાં લાગી ગયો છું. જે નિમિતે આજરોજ તા. ૪-૧૧-૯૪ ના રોજ સંકલ્પ પ્રમાણે અડધો પગાર સદગુરૂ ચરણે મુકી શીશ નમાવી આભાર વશ થઇ ઋણ મુક્ત થયો છું સદગુરૂશ્રીને મારા લાખ લાખ દંડવત પ્રણામ!

દિલિપ વી. ઠક્કર બારેજા જી. અમદાવાદ.

જીવનનો સાચો રાહ

—જેઠાભાઈ સી. પટેલ
દહેગામ

દિન ગુમાયા દુનિયામાં, દુનિયા ચલી નાં સાથ,
પાઉં કુહાડા મારીઆ રહે, ગાફીલ અપને હાથ.

આખું જીવન મનુષ્ય દુનિયામાં દીવાનો બનીને પુરૂ આયુષ્ય ખર્ચી નાખે છે. પણ પોતાનાં "કલ્યાણ" માટે કરવાનું બધું જ ભૂલી જાય છે. જેમ સરોવરમાં વરસાદનું પાણી એકત્ર કરવું હોય તો પ્રથમ પાળ બાંધવી પડે છે. પાકથી લહેરાતા ખેતરનું રક્ષણ કરવું હોય તો પ્રથમ વાડ કરવી પડે છે. તેમ જીવનનું રક્ષણ કરવા માટે પ્રથમ નિતી-નિયમનું આચરણ કરવું પડે છે. માણસ જ્યારે સત્તા-સંપત્તિ ગ્રહણ કરે છે, ત્યારે નિતી-અનિતીનો માર્ગ ભૂલી જાય છે. જ્યારે જીવનની દોડ પૂરી થવા આવે. પોતાનો સૂર્ય અસ્ત થવા આવે ત્યારે અફસોસ કરી હતાસા અનુભવે છે.

"મનુષ્ય જનમ મુક્તિનો દ્વાર તે નહીં પામો વારંવાર." આજનો મનુષ્ય ઋણ મુક્ત થવાના બદલે ઋણ બંધનમાં જકડાય છે, અને બીજા જન્મમાં તે ઋણું ચૂકવવા અનેક પ્રકારના દંડ-સજા અને પરિધાનતાનો બોજ ઉઠાવી જીવન વ્યતિત કરવું પડે છે. પશુ યોનીમાં જીવન મૂકાઈ દુઃખી થાય છે. ત્યારે વિચાર કરે છે કે "હે પ્રભુ, હવે અંતઃકરણથી તમારી ભક્તિ કરીશ, પણ મને આ કારાવાસમાંથી મુક્ત કરી મનુષ્ય તન આપો. આવી કાકલુદી-કબૂલાતો અનેકવાર કરીને ભૂલેલો જીવ નર્કના મુખમાં ધકેલાય છે. સદ્દગુરૂશ્રી ઇમામશાહ મહારાજ કહે છે કે ચાર યુગ વહી ગયા છતાં વચનપાલન ના કર્યું. હવે મહા પ્રલય આવે છે ત્યારે ભયંકર માર સહન કરવો પડશે. હજુ હાથમાં છે બાજી, કરી લો પ્રભુને રાજી" આ છેલ્લો મનુષ્ય અવતાર માની ભક્તિનો રાહ અપનાવી આત્માનું કલ્યાણ કરવા તત્પર થવું અત્યંત જરૂરી છે.

□

realpatidar.com

https://archive.org/details/bk107/page/n18/mode/1up

realpatidar.com

-: શિબિર અંગે પત્રથી પ્રતિસાદ :-

પ. પૂ. વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ
શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા, જી. અમદાવાદ.

સાદર પ્રણામ,

સહર્ષ જણાવવાનું કે માનકુવા (કચ્છ) મુકામે યોજાયેલ બાળ શિક્ષણ શિબિરમાં મેં હર્ષભેર ભાગ લીધો !! તેથી મારૂં જીવન ધન્ય બની ગયું !!! આ શિબિરમાં અમને અમૂલ્ય સુસંસ્કારોનું સિંચન કરનારા શિક્ષક ભાઈ-બહેનોનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. તેમને અમારા માટે જે ભોગ આપ્યો છે. તેને અમો કયારેય ભુલી શકીએ તેમ નથી. શિબિર માંથી આપેલ પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણે પાલન કરીએ છીએ. જેમાં અમારા વડીલો તથા માતા-પિતા તરફથી નોંધપાત્ર સહકાર મળે છે.

ભવિષ્યમાં પણ આવી જ શિબિરો યોજાતી રહે તો અમારા જેવી ઉછરતી પેંઢીને પાયાથી જ વાણી-વર્તન-સદ્ગુણોમાં સુધારો થઈ શકે તેમ છે !!! આ શિબિરનું આબેહુબ આયોજન કરી અમને ઉમદા ધાર્મિક શિક્ષણ પુરૂ પાડવાનું શુભ કાર્ય કરનાર આચાર્યશ્રી, આયોજકો, દાતાઓ શિક્ષક ભાઈ-બહેનોને કોટી કોટી વંદન !!!

-જયશ્રીબેન એસ. સેંઘાણી, મેરાઉ -નિલેશ કે. રામજીયાણી, કુરબઈ (કચ્છ)
-દક્ષા એમ. પટેલ, માધાપર (કચ્છ)

પ. પુ. આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ તથા અન્ય સાધુસંતો, આયોજકો,

સાદર દંડવત પ્રણામ !!!

સહર્ષ જણાવવાનું કે સતપંથ બાલ બાલિકા શિક્ષણ શિબિર માનકુવા (કચ્છ) મુકામે તાજેતરમાં યોજાઈ ગઈ જેમાં મેં ઘણા જ ઉમંગથી ભાગ લીધો. આ શિબિરમાં ભાગ લેવાથી આચાર્યશ્રી કરસનદાસજી મહારાજના માર્ગદર્શન અને અન્ય સાધુ સંતો મહાનુભાવોના પ્રવચનથી મેં ઘણું જ ભાથું પ્રાપ્ત કર્યું છે. મારા જીવનમાં નિશંક સારા સંસ્કારોનું સિંચન થયું છે. પહેલાં અમો બ્રેક વગરની ગાડી સમાન હતા !! શિબિરમાં જોડાયા બાદ જ્ઞાન અને સારા સંસ્કાર રૂપી બ્રેક લાગવાથી અમારૂ જીવન ધન્ય બન્યું છે !!! શિબિરમાં આવ્યા પહેલાં અમો ફુલની બિડાયેલી કળી સમાન હતાં. છ દિવસના અભ્યાસક્રમથી બિડાયેલી કળીમાંથી સુવાસિત ફુલો બની અમો મહેંકી ઉઠયાં છીએ. આપણા સંપ્રદાયની સુગંધ ચોમેર ફેલાઈ છે !!! જે આપણા સૌ માટે અતિ આનંદની વાત છે.

-મીનાબેન વી. પોકાર, દુજાપર (કચ્છ)
-અરૂણાબેન ડી. પટેલ, ખેડોઈ (કચ્છ)

realpatidar.com

https://archive.org/details/bk107/page/n19/mode/1up

realpatidar.com

પ. પૂ. વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ,

સાદર પ્રણામ,

સહર્ષ જણાવવાનું કે મેં પહેલી વખત જ માનકુવા (કચ્છ) ખાતે યોજાયેલ શિબિરમાં ભાગ લીધો. આ શિબિરમાં અમોને ખુબ મજા આવી! શિબિરના નિયમોનું અચુક પાલન કરું છું. મારા ગામમાં સતપંથ સંપ્રદાયનું મંદિર નથી પણ ઘર એજ મંદિર સમજીને હું નિત્યક્રમ મુજબ પ્રાર્થના, આરતી વિગેરે અચુક કરૂં છું. શિબિરની દરેક પ્રતિજ્ઞાઓનું પાલન કરૂં છું. શિબિરમાં સ્થાન મળ્યું તેને હું મારૂં અહોભાગ્ય સમજૂ છું. શિબિર દરમ્યાન શિક્ષક-ભાઇ-બહેનો આચાર્ય શ્રી સંતો, વડીલો મહાનુભાવોએ જે સર્વશ્રેષ્ઠ જ્ઞાનનું ભાથું પીરસ્યું છે. તે અમો જીંદગીભર સાચવી રાખીશું! કારણ કે જેનાથી અમોને નવો રાહ મળ્યો છે અને અગામિ શિબિરની આતુરતાથી રાહ જોઉં છું.

–હંસા આર. પટેલ ધાવડા (કચ્છ)

પ. પૂ. વંદનીય વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ તથા સર્વ સતપંથીજનોને

સાદર પ્રણામ,

સહર્ષ જણાવવાનું કે માનકુવા ખાતે યોજાયેલ શિબિર ખુબ જ યાદ આવે છે. શિબિરનો આનંદ અવર્ણનીય છે શિબિરમાં અમને ખુબખુબ જાણવા મળ્યું ત્યાં પધારેલ દરેકે-દરેક સાધુ-સંતો તેમજ મહાનુભાવોએ અમને શ્રેષ્ઠતમ જ્ઞાન આપ્યું છે. અમો દરેક બાળકો સાથે મળી સવાર-સાંજ મંદિરે જઈએ છીએ અને શિબિરના નિયમોનું અચુક પાલન કરીએ છીએ. અમારાથી આપશ્રીને કાંઇ કષ્ટ અપાઇ ગયું હોય તો માફ કરશો!!!

–તુલશીદાસ એન. પટેલ જીયાપર (કચ્છ)
–કુ. મનિષા કે. પટેલ નાનીખાખર (કચ્છ)
–રણછોડ વી. પટેલ કોટડા (કચ્છ)
–હસમુખ હી. સેંઘાણી મેરાઉ (કચ્છ)

પ. પુ. વંદનીય વિરવર આચાર્ય શ્રી કરશનદાસજી મહારાજ

સાદર દંડવત પ્રણામ

સહર્ષ જણાવવાનું કે શિબિરમાં ભાગ લેવાથી અમારૂ જીવન ધન્ય બન્યું છે. જેને મારા જીવનનો યાદગાર પ્રસંગ કહી શકાય આ શિબિરમાંથી જીંદગીભરનું મહામુલું ભાથું એકઠું કર્યું છે. શિબિર દરમ્યાન મળેલ પ્રતિજ્ઞાઓનું અચુક પાલન કરીએ છીએ. અમારા અંગીયા ગામમાં દર રવિવારે બપોર પછી ૩ થી ૫ વાગ્યા સુધી બધાં બાળકો ભેગા મળી એક મીની શિબિરનું આયોજન કરીએ છીએ. અમારા ગામમાંથી જે તજજ્ઞ બહેન શિબિરમાં આવ્યાં હતાં તે અમને ખંતથી અભ્યાસ કરાવે છે આ કામમાં પ્રોત્સાહીત કરવા અમારા ગામના મુખી તથા વડીલો અંગત રસ લઈ અમોને ખુબ જ મદદરૂપ થાય છે.

જેમ ચાતક પક્ષી વદસાદની રાહ જુએ તેમ અમારા ગામનાં દરેક બાળકો આગામી શિબિરની રાહ જુએ છે. સર્વે સંતો-ભક્તોને મારા કોટી કોટી વંદન!!!

–રમેશ એમ. રૂડાણી નાના અંગીયા (કચ્છ)

realpatidar.com

https://archive.org/details/bk107/page/n20/mode/1up

realpatidar.com

શિબિર અંગે તજજ્ઞ બહેનોનો પત્રથી પ્રતિભાવ

પ. પુ. પરમ વંદનીય વિરવર આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ તથા સંતો-વડીલો સર્વે ક્ષેમ કુશળ હશો. !

સહર્ષ જણાવવાનું કે તાજેતરમાં માનકુવા (કચ્છ) ખાતે યોજાઈ ગયેલ બાળ-શિક્ષણ શિબિરમાં મને તજજ્ઞ બેન તરીકે સેવા કરવાનો જે મોકો મળ્યો તેનાથી મને અનહદ આનંદ થયો છે. જે આનંદને હું શબ્દોમાં વર્ણવી શકુ તેમ નથી. માનકુવા (કચ્છ) ખાતે અમને જે માન-અને મોભો મળ્યો તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ઘેર આવ્યા બાદ શિબિર નજર સમક્ષ જ લાગે છે. અને આગામી શિબિરમાં પણ મને સેવા કરવાની તક મળે તેવું હું ઇચ્છું છું. તો જ્યારે જ્યારે મારી સેવાની આપશ્રીને જરૂર જણાય ત્યારે અચુક મને જણાવશો હું ખડે પગે સેવા આપવા હાજર રહીશ !!

–ગીતા એન. પટેલ મહાદેવપુરા (મોડાસા)
–કલ્પના આર. પટેલ રવિપુરા (મોડાસા)

પ. પુ. પરમ વંદનીય વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ તથા અન્ય વડીલો-સાધુ સંતો તથા અમારામાં સંસ્કારોનું સિંચન કરનાર શિબિરના પ્રણેતા અમારા સૌના "દાદા" શામજી બાપા તથા અન્ય કાર્યકરો.

સહર્ષ જણાવવાનું કે તાજેતરમાં માનકુવા (કચ્છ) ખાતે યોજાયેલ બાળ શિક્ષણ શિબિરમાં મને તજજ્ઞબેન તરીકે સેવા આપવાનો ચાન્સ મળ્યો જેનાથી હું અનહદ આનંદ અનુભવું છું. સાક્ષાત સત સંમેલનનું મીની સંમેલન જ હતું. અને હા....મહંતશ્રી શાસ્ત્રી પુરૂષોત્તમ ચરણદાસજી (સ્વામી નારાયણ, ગુરૂકુળ કુંડાલા-ગાંધીનગર) એ માનકુવા વિષે ખુબ જ સારી રીતે કહ્યું કે પ્રથમ એવું અક્ષર "મા" અને છેલ્લો અક્ષર "વા" મળી "માવા" અર્થ થાય છે. તો આવા ગામમાં આવી આપણે સૌ ધન્ય બન્યા છીએ. ! સદભાગી બન્યા છીએ !

બીજું કે જ્યારે જ્યારે આવી શિબિરો યોજાય ત્યારે મને જાણ કરશો. હું અચુક સેવા કરવા દોડી આવીશ !

ગીતાબેન બી. પટેલ વજેપુરા (બાયડ)
કંચનબેન એમ. પટેલ મોહનપુરા (મોડાસા)

પ. પૂ. પ્રાતઃ સ્મરણીય વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ, સાધુ-સંતો, સતપંથ બાળ શિક્ષણ શિબિરના આયોજકો તેમજ ભક્તજનોને મારા કોટી કોટી વંદન !

સહર્ષ જણાવવાનું કે માનકુવા (કચ્છ) ખાતેની બાળ શિક્ષણ શિબિરમાંથી ઘેર આવ્યા બાદ બિલકુલ ગમતુ નથી. ત્યાં મને તજજ્ઞબેન તરીકે સેવા કરવા મળી જે મેં સહર્ષ બજાવી, શિબિર પૂર્ણાહૂતિ બાદ શિબિરાર્થીઓથી અને અમારા તજજ્ઞ ભાઈ-બહેનોથી છુટા પડવાનો સમય આવ્યો ત્યારે બધાંની આંખમાં આંસુ-હતાં ! માનકુવા (કચ્છ) ખાતેની શિબિર એ અમારા જીવનનો એક યાદગાર પ્રસંગ બની રહેશે જેને ભુલવુ અશક્ય છે. શિબિર દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતાં કરતાં ખુદ અમારાં પણ સિંચન થઈ ગયું છે. અમારા જીવનમાં ઘણુ પરિવર્તન આવ્યું છે.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n21/mode/1up

realpatidar.com

શિબિરનો આનંદ અવર્ણનીય છે. જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકુ તેમ નથી ગ્રામજનો મને શિબિર વિષે પુછે છે ત્યારે શિબિરનો આનંદ કેમ વ્યક્ત કરવા તેજ મને સમજાતુ નથી. પણ હું એ હું તો કહીશ કે આવી શિબિરો વારંવાર યોજાતી રહે અને વધુને વધુ શિબિરાર્થીઓ તેનો લાભ લેતા રહે!

અને અંતમાં શિબિરો યોજવા બદલ આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ, આયોજકો, દાતાઓ, વિગેરેને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

સુમિત્રાબેન કે. પટેલ કરસનપુરા (મોડાસા)
બિનાબેન ડી. પટેલ વડોદરા

શિબિર અંગે પત્રથી પ્રતિસાદ :-

ગત તા. ૧૨-૧૧-૯૪ થી ૧૭-૧૧-૯૪ સુધી માનકુવા સ્થળે ચાલેલી શિબિરમાં ભાગ લઈ નાના અંગીયા મુકામે પરત આવેલા ભાઈ-બહેનોની તા. ૧૯-૧૧-૯૪ની રાત્રે ૮-૦૦ વાગે "જ્યોતિ ધામ" હોલમાં સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાન શ્રીમાન કરસનભાઇ હરજીભાઈ પટેલે શોભાવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે પૂ. ભાણજીબાપા, મુખીશ્રી વસ્તાભાઈ દેવશીભાઇ પટેલ તથા મુખીશ્રી રતનશીભાઈ કેશરાભાઈ પટેલ તેમજ ખાસ આમંત્રિત મહેમાન તરીકે ડો. સુરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માનકુવા ખાતે શિબિર તજજ્ઞ તરીકે સેવા આપેલ બહેનોમાંથી કુ. જશોદાબહેન એસ. પટેલે તેમનું મંતવ્ય રજુ કર્યું હતું. તેમજ શિબિરાર્થી ભાઇબહેનોએ પોતાના અનુભવો વાગોળતા જણાવેલ કે વિરવર પ. પૂ. આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ અને શિબિરના જન્મદાતા પૂ. દાદા શામજીબાપાના ખૂબ ખૂબ આભારી છીએ. જેમના થકી અમને આ શિક્ષણ મેળવવાનો ઉજળી તક મળી. સ્વયંસેવક વૃંદના કપ્તાન શ્રી કેશરાભાઈએ જણાવ્યું કે શિબિર દરમ્યાન સેવા કરવાની અમોને ઉત્તમ તક મળી છે અને ભવિષ્યમાં યોજનાર આવા કાર્યક્રમોમાં આથી પણ વધુ સંખ્યામાં અને વધુ ઉત્સાહથી સેવા આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ. પૂ. સંતશ્રી ભાણજીબાપાએ ધાર્મિક પ્રવચન આપી બાળ શિબિરનું મહત્વ સમજાવ્યું હતું. કેટલાક યુવાનોએ વ્યસન મુક્ત રહેવાની પ્રતિજ્ઞા જાહેર કરી હતી, શિબિરાર્થીઓએ દર રવિવારે અભ્યાસ વર્ગ ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું. સન્માન કરવામાં આવેલ દરેકને દાતાશ્રી કરસનભાઈ, M/s મેઘાણી વેલ્ડીંગ વર્કસ, કરમશીભાઈ ભાણજીભાઈ પટેલ, તથા સંત શ્રી ભાણજીબાપા તરફથી સ્ટીલના ગ્લાસ, વાટકી, બોલપેન તથા રોકડ રકમ આપવામાં આવેલ તેમજ પ્રસાદ માટે અનેક દાતાઓએ સહયોગ આપેલ.

અંતમાં આરતીના સમુહ ગાન પછી શ્રીમાન મેઘજીભાઈ કરમશીભાઈ પટેલે આભારવિધિ કરી હતી!!! આ સુંદર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી મનુભાઈ વસ્તાભાઈ મુખીએ તથા શ્રી જયંતિભાઈ હીરાલાલ પટેલે કર્યું હતું. છેલ્લે આવી બાળ શિબિરો ફરી ફરી યોજાય અને જવાની તક મળે તેવી સૌએ ઇચ્છા વ્યક્ત કરી હતી.

—કરમશીભાઈ વ. પટેલ, નાના અંગીયા (કચ્છ)

realpatidar.com

https://archive.org/details/bk107/page/n22/mode/1up

realpatidar.com

સત્પંથ જ્યોત અંગે પત્રથી પ્રતિસાદ

મગનભાઈ જે. પટેલ
નાસીક (M.S.)

પ્રથમ પ. પૂ. વંદનીય આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ તેમજ અન્ય સાધુ-સંતો તેમજ સેવકોને મારા સાદર દંડવત્ કોટી કોટી વંદન....

દિપોત્સવી અંક વાંચી અતિ આનંદ થયો અને " ગુરૂ પ્રવાસે સત્પંથી એકતા સર્જી " ભીખુભાઈ પત્રકારનો લેખ જાણે ઘેર બેઠા જ અખિલ ભારતીય સંત સમિતિના સાક્ષાત દર્શન થયાં અને આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ પોતાની આગવી ચાવીરૂપ ભૂમિકા ભજવતા વર્ણવ્યા મને એમ લાગે છે કે સત્પંથ ધર્મ ભારતની પવિત્ર ભૂમિ ઉપર પ્રસરતો જાય છે. આનંદની વાત છે " કે. સી. વૈદ. " ની તદ્દન નવી વાનગી વાંચી એને જીવનમાં ઉતરવા જેવી છે. અને ભીખુભાઈ પત્રકારનો ગુજરાત દર્શન લેખ વાંચી જાણે એમ લાગ્યું કે ગુજરાતનાં દર્શન કર્યા અને બાલ શિબિરની ખોલી શાળા એ લેખ ખરેખર સમજવા જેવો છે, અને આપણા બાળકોને બાલ શિબિરમાં મોકલીએ. એવી આજના યુગની ખાસ જરૂરિયાત છે.

દયા અને કર્મ એ જ મોટો ધર્મ

કુ: કુંદન પટેલ
તાંદલીયા (ખેડબ્રહ્મા)

શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે માનવી ભૂલથી દુષ્ટકર્મ; પાપાચાર કરે અને હૃદયથી પ્રભુને પ્રાર્થના કરે તો ઇશ્વર તેને માફ કરી દે છે.

જેવું કર્મ એવું ફળ એ તો જાણીએ છીએ છતાં કર્મ જાણતાં-અજાણતાં, જાહેરમાં કે ખાનગીમાં થતુ હોય છે. પણ તેની નોંધ આપણા પોતાના જ કોમ્પ્યુટરમાં થાય છે. અને તે કોમ્પ્યુટર આપણને આપણો પ્રતિબિંબ આપશે જ. એટલે આપણે બેફિકર થવાની જરૂર નથી. આપણા ગુનાનો પ્રથમ સાક્ષી આપણો આત્મા છે, જે હંમેશાં આપણને કાંટાની જેમ ડંખે છે.

જીવ માત્ર પર દયા રાખવા જેવો કોઈ ધર્મ નથી. એક વિદ્વાન પુરુષે શ્લોકમાં કહ્યું છે કે...

: क्षान्तितुल्यं तपो नास्ति न तोषात् परमं सुखम् ।
: नास्ति तृष्णापरो व्याधिर्न च धर्मो दया परः ॥

:- ક્ષમા જેવું બીજુ તપ નથી. સંતોષથી ઉત્તમ સુખ નથી, તૃષ્ણા જેવો બીજો રોગ નથી અને દયા જેવો બીજો ધર્મ નથી.

Coming to gether is a Beginning
Stayіng to gether is a Progress,
Growing to gether is a Success

સંકલન : જી. કે. પટેલ વજેપુરા (S.K.)

realpatidar.com

https://archive.org/details/bk107/page/n23/mode/1up

realpatidar.com

સંસ્થા–સમાચાર

શ્રી સતૂપંથ પ્રેરણાપીઠ પીરાણાના પીઠાધિપતિ પ. પૂ. વિરવર આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ (સંરક્ષક–અખિલ ભારતીય સંતસમિતિ ગુજરાત પ્રદેશ)

આ વર્ષે અખિલ ભારતીય સંત સમિતિના અગીયારમા અધિવેશનનું તા. ૨૬–૧–૯૫ થી તા. ૨૮-૧-૯૫ સુધી પ્રયાગરાજ (અલ્હાબાદ) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હાજરી આપવાના છે. અધિવેશન બાદ પૂ. આચાર્યશ્રી કરસનદાસજી મહારાજ સંતોની મુલાકાત માટે વારાસણી (કાશી) અને હરદ્વાર જવાના હોઈ તા. ૨૨–૧–૯૫ થી ૩૦–૧–૯૫ સુધી પૂ. આચાર્યશ્રીનો કોઈ કાર્યક્રમ કે પ્રોગ્રામ રાખવો નહીં. જેની નોંધ લેવા વિનંતી છે.

સંપાદક : શ્રી સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા. જિ. અમદાવાદ.

શ્રદ્ધાંજલિ

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માનનીય શ્રી જ્ઞાનિ ઝૈલસીંગ તા. ૨૫–૧૨–૯૪ ના રોજ હૃદયરોગના નાજુક હુમલાથી અવસાન પામ્યા છે.

સતપંથ સમાજ અને સંપ્રદાય તેમના અવસાન નિમિત્તે ઘેરા શોકની લાગણી પ્રગટ કરે છે. અને સતપંથ પ્રેરણાપીઠના વંદનીય આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજના પ્રમુખપણા નીચે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમના આત્માને પ્રભુ શાંતિ આપે. દેશે એક મહાન રાષ્ટ્ર ભક્તને ગુમાવ્યો છે તેની ખોટ સદાને માટે દેશને વેઠવી પડશે.

□

કન્યા વિક્રય મહા પાપ છે.

(અંક ૧૨ થી ચાલુ)

ભોળોભટ, "અરરર! આ વનાશા શેઠે પોતાની એકની એક દીકરીનું ભલું વાંચ્યું? પોતાની દીકરી સિવાય બીજું કાંઈ સંતાન નથી. અમે તો આટલું આપીશું. પણ દીકરીને લુંટયા જેવું કહેવાશે. આ વીસ હજાર રૂપિયા દીકરીના ઘરમાંથી જવાના. તેથી દીકરી ભણેલી અને સમજણી હશે તો રાજી નહિ થાય; તેમ ઇશ્વર પણ રાજી નહિ રહે. ભલે, જ્યારે એની એટલી રકમ લેવાની મરજી છે તો હવે અમારે વીસ હજાર રૂપિયા આપવા કબુલ છે. પણ ઊઠો, આજ ને આજ ચાંલ્લા કરાવી આપો."
વનાશા અને તેમની પત્ની દિવાળીબાઈ.

હવે ગાંડારામ ગયા પછી શેઠ પોતાની સ્ત્રી દિવાળીને કહે, "સાંભળ્યું કે? આજે આપણાં તથા વિદ્યાવતીનાં નસીબ ઊઘડી ગયાં. આપણા આ ગાંડારામ ગોરને પગલે આપણને ઘેર બેઠાં ગોળનું ગાડું મળ્યું. ગમે તેમ પણ ગોર કાચો નથી."

દિવાળી, "ઘણી ઘંટીનો લોટ ખાનારો કાચો કેમ હોય? જરૂર એ આપણી ધારેલી રકમ પૂરી દેશે."

શેઠ, "આપણને પુત્ર નથી. પૈસે ટકે પણ કમી નથી. આટલી રકમ મળશે તો આપણને સગાં વહાલાની કે કોઈની ગરજ રહેશે નહિ. આપણે સૌથી સવાયા ગણાઈશું. આપણે મોટી રકમ માટે જ વિદ્યાવતીને વિવાહિત કરવામાં ઢીલ કરી છે. પણ હવે આપણા તકદીરનો તબેલો ખૂલ્યો. ગોર પૂરેપૂરા વીસ હજાર કહેશે.

દિવાળી, "એટલા ન મળે તો ભલે ઓછા મળે, પણ હવે વિદ્યાવતીનું ઠેકાણું જલ્દી કરી નાખો, આપણે છેલ્લી ઉંમરે પહોંચ્યા છીએ કોણ જાણે કાલે શું થશે? સીતાજીએ જાણ્યું કહતું કે મને વનવાસ થશે? કે રાવણ હરણ કરશે? કે મારા વચનથી મોટી રામાયણ થશે?

realpatidar.com

https://archive.org/details/bk107/page/n24/mode/1up

realpatidar.com

માટે જેમબને તેમ વિદ્યાવતીનો વિવાહ જલ્દી કરી નાખવો જોઈએ.

વનાશા, "ધીરી રહે અકળાઈશ નહિ ગોર હમણાં આવવો જોઈએ. ગઈ કાલે બધો ખુલાશો કર્યો છે." આમ વાત કરે છે ત્યાં તો ગોર ગાંડારામ તથા ભોળાભટ બંન્નેને આવતા જોઈ દિવાળી બાઈ કૂદવા મંડી "આવ્યો ગોર!" વનાશા કહે, આવો મહારાજ, ભૂદેવો ! પધારો. આ આસન પર બિરાજો "એમ કહી બંન્નેને આસન નાખી આપ્યાં ગાંડારામ ભોળાભટ સામી આંગળી કરીને કહે, "શેઠ આં મહારાજ વૃષભ-નગરથી આવ્યા છે. આમને ગઈ કાલે આપણી વચ્ચે થયેલી વાતચીત કરી છે. આપના કહેવા મુજબ આ મહારાજ વિધાવતીના વીસ હજાર રૂપિયા આપવા કબૂલ થાય છે."

વનાશા, "મહારાજ ! હવે વાર શું કરો છો ? કરો કબુલાત નામું."

કબુલાત નામું. "વૃષભનગરના રહેવાશી ખબાશા શેઠ સાથે તમારી પુત્રી વિધાવતીના લગ્ન આજે કર્યા બાબતના રૂપિયા વીસ હજાર મુંબઈગિરા રોકડા અમોને આપવા ઠરાવેલા છે, તે આપણે બંને ને કબુલ મંજુર છે. આમાં કોઈ ફર્યું બોલે તેને ગેબલશાપીર, રામાપીર અને હનુમંતવીર પુછે." આ લખ્યા પછી.

ભોળોભટ, "શેઠ! તમારાં સગાં-વહાલાં ને તથા ગામના આગેવાનોને જેને બોલાવવા હોય તેને બોલાવો." એટલે વનાશા એ સગાં-વહાલાં, આડોશી-પાડોશી, શેઠ શાહુકાર અને મતાદાર સર્વેને તેડાવ્યા સૌના દેખતાં ચાંલ્લા કર્યા અને સૌને ખોબે ખોબે સાકર વહેંચી ભલે ભલે કહેવરાવ્યું.

વનાશા, "ભોળાભટ,! લગ્ન જેમ વહેલા આવે તેમ કરજો અમારી બન્નેની અવસ્થા છે. સારા કાર્યમાં સો વિધ્ન પૂડે. કેમ ગાંડારામ ગોર ! આ મારું કહેવું ખરું છે ને ?"

ગાંડારામ, "હા, આવતી અખાત્રીજનું મુહર્ત ઊંચું છે. માટે ભોળાભટ! ઘેર વહેલા જાવ અને અખાત્રીજનું મુહૂર્ત નક્કી કરી જાન લઈ વહેલા આવજો.

ખબાશાની ખુશાલી.

ભોળોભટ ત્યાંથી બીજે દિવસે નીકળી વૃષભનગર ગયો. અહી ખબાશા તો ભોળાભટ સામી મીટ મરડી એક ટશે રાહ જોઈ રહ્યો હતો ત્યાં તો છેટેથી ભોળાભટને ઉપડતે ઉપડતે પગે આવતો દેખી હાથ હાથ કુદવા મંડયો શાબાશ, "ભોળાભટ ! બોલો સિંહ કે શિયાળ ?"

ભોળોભટ, "ભાઈ, સિંહ ! સિંહ ! તમારું ચોકઠું બેસાડી દીધું, વિરાટપુરીમાં વનાશાની વિધાવતી નામની પુત્રી વેરે તમારું વેવિશાળ વીસ હજાર રૂપિયામાં કરી લાવ્યો છું. અને લગ્ન પણ પંદર દહાડા પછી આવતી અખાત્રીજનું નકકી કર્યું છે. હવે સઘળી તૈયારી કરવા માંડો. કન્યા મોટી, ભણેલી. ગણેલી, રૂપે દેવાંગના જેવી છે. આ વિષે મારે બડાઈ માર્યા જેવું કહેવાય પણ જ્યારે દેખશો ત્યારે ખબર પડશે." આ સાંભળી ખબાશા હર્ષ ઘેલો થઈ કહેવા લાગ્યો, "ગોરદેવ! તમે અમારા ગોર, પૂજનીય છો. તમારા કામથી ઘણો રાજી થયો છું."

ભોળાભટ, (હસ્તે મુખડે) "શેઠ? તમે રાજી થયા. પણ મને રાજી કરવો જોઈએ." શેઠ, "ધીરા રહો, બધા સારાં વાનાં થશે."

હવે થોડા દિવસ થયા કે મુહૂર્ત નજીક આવ્યું. સર્વ પ્રકારે સઘળી તૈયારી કરી. ખબાશા, "ભોળાભટ ! ખબર છે ને અખાત્રી જ નજીક આવી ? હવે પરવારજો!"

ભોળાભટ, "તે તો બધું ઠીક લગ્ન કરવા છે તે જાન લઈ જવી પડશે પણ મારું કાંઈ કર્યું ?"

ખબાશા, "હમણાં બોલશો નહિ. પરણીને આવ્યા પછી તમને રાજી કરીશ. તમે ચિન્તા કરશો નહિ.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n25/mode/1up

realpatidar.com

ભોળોભટ, "શેઠ! એ વાતનો કાંઈ વાયદો ન હોય. પરણ્યા પછી કોણુ ભાવ પુછે? ગુમડું ફાટયું ને વૈદ વેરી! ઠીક! ત્યારે હવે તમે જાન લઈને જજો. મારે તો હમણાં ખાનગી ઘરકામ છે તે જાનમાં અવાશે નહિ." એમ કહી ઉઠવા જાય છે. ત્યાં તો ખબાશાએ ધોતિયું ઝાલ્યું, "મહારાજ! બેસો બેસો ઉતાવળા ન થાવ. આ એક વખતનું કામ છે? તમારા હાથે તો આવાં ઘણાંય કામ કરવાં છે. અકળાવ છો શું કરવા?"

લોળો ભટ, "ઘણાં કામ હોય તો કરજો. એમ કહી ઉઠે છે. તો ફરી 'બેસો બેસો' કહ્યું."

ભોળોભટ, "બેસીને શું કરવું? તમને માણસની કે તેના કામની કાંઈ કદર છે? તમે તમારી હઠ મુકતા નથી. પણ શેઠ! તમને બુઢાને તે કોણ કન્યા આપે? આ રત્નરૂપ કન્યા મળી તે તો આ લોળાભટના પગનો પ્રભાવ છે."

ખબાશા, "ભોળાભટ! અકળાશો કે રિસાસો નહિ. મારે વાંસેથી રાજી કરવા છે તે હમણાં જ કરું, પણ કદાચ કન્યામાં કોઈ જાતની ખોડ-ખાપણ નીકળે તો કેમ કરવું?"

ભોળોભટ, "તેની તમારે શી ચિન્તા છે? અમે કર્યું તે સવાવીસ ને સાંબેલું ઉપર. એમાં કાંઈ ખોડખામી નીકળે તો મારાં નાક-કાન જાય. મારાથી નાત-જાત કે ગામમાં મોઢું દેખાડાય નહિ. સમજ્યા!"

ખબાશા, "એમ જો હોય તો લ્યો, આ ઇનામમાં પાંચસો રૂપિયા અને પ્રથમ ખરચી સારું આપ્યા છે તેમાંથી બચત હોય તે પણ તમને આપ્યા. લ્યો હવે રાજી થયા? અને જાનમાં આવશો ને?"

ભોળોભટ, "હા, જજમાન રાજા! હું આવીશ તમારું શોભાવી દઈશ તમારે કોઈ ચિન્તા રાખવાની નથી."

ખબાશાની જાન વિરાટપુરી જવા નીકળી....

સૌ વિરાટપુરી પહોંચ્યા વનાશાએ વાજતે ગાજતે સામૈયું કર્યું સૌને જાનીવાસો આપ્યો. વિદ્યાવતીની સાળીઓ તથા બીજી કેટલીક બાઈઓ તથા ભાઈઓ સહુ વિદ્યામતીના વરને જોઇને મોં મરડવા અને હૈયાની વરાળ કાઢવા લાગ્યાં, "અરે! હાય હાય!"

આ વનાશાને શું સૂઝયું? આ બિચારી કુમળી કન્યાને કુવામાં નાખી, અરે આ તો સવા ટરચો? બિચારી છોડીનો ભવ બગાડયો. પોતે પૈસા લઈ તાગડધિન્ના કરશે અને આ બિચારીના રોઈ રોઈને દહાડા જશે! આ તો મા-બાપ કે કસાઈ?

રૂપિયાના લોભે આ છોડીનો ભવ બગાડયો. ભગવાન આમનું શું ભલું કરશે?" આમ સૌ બોલીને વનાશાને ફિટકારવા અને શાપ દેવા લાગ્યા. કેટલાકે તો રૂબરૂમાં પણ કહ્યું કે, "વનાશા કાકા! ધનલાલચથી તમે છોડીનું બહુ ભૂંડુ કર્યું. આ એકની એક વહાલી દીકરીને દુ:ખના દરિયામાં ફેંકી, સ્વાર્થ સાધી લીધો. બિચારી નાની બાળકી શરમને લીધે કાંઈ કહી શકી નહીં. હવે તમારા ઉપર અંતરનો બળાપો કાઢશે અને ગાળોનો વરસાદ વરસાવશે. શેઠ! હજુ પણ કાંઈક સમજો અને આ ખબાશાને પાછો વીલે મોંઢે કાઢો. અરે! જુઓ તો ખરા! આ ખબાશાનું ડાચું ખાળ જેવું ગંધાય છે! લથડિયાં થાય છે, આંખોમાંથી પાણી નીતર્યા કરે છે. અરે! આવા બુઢીયાને દેવ જેવી કન્યા આપી બિચારીને દુ:ખમાં નાખી! આમાં વનાશાનું તથા તેની સ્રી દિવાળીનું શું સારું થશે?" આમ સહુ કહેવા મંડયા.

વિદ્યાવતીના મનનો ઉકળાટ : વિદ્યાવતીએ પણ બારીમાં બેસી ભવિષ્યમાં થનાર ભરથારનું મોઢું જોયું ત્યારથી તે હોશકોશ વિનાની થઈ રોયા કરતી. દિવાળી તેને સમજાવતી. વનાશ પણ રોઇને તેને હાથે-પગે લાગી સમજાવતો

realpatidar.com

https://archive.org/details/bk107/page/n26/mode/1up

realpatidar.com

આમ ધમારોળ થઈ રહી છે, ત્યાં તો ગોર ગાંડારામ ઘરમાં આવી કહે, "શેઠ! શું ધાર્યુ છે? બધાં કન્યાને પધરાવવાની વાટ જોઈ રહ્યા છે."

વનાશા, "ભાઈ! શું કરવું? છોકરી હઠીલી થઈ ચુલા આગળ બેઠી છે, તે ઉઠતી નથી. મેં તો ઘણી ઘણી સમજાવી, પણ કહે છે કે "હું મરીશ પણ આ પીટયા બુઢીયાને નહીં વરું."" પછી ગોરે તથા મા-બાપે ઘણું ઘણું સમજાવી, પણ ઉઠી નહિ અને કહે છે કે "તમે મને પરાણે મોકલી રિબાવી રિબાવી મારશો તે કરતાં અત્યારે જ અહીં મારી નાખોને!"

ત્યારે મા-બાપે ઘણું ઘણું રોઈને આંસુ કાઢયાં. બાપ કહે કે "બેટી! જે થયું તે ખરું, હવે ઉઠ અને હઠ નહિ મૂકે તો આબરૂનો માર્યો જરૂર જીભ કચરીને મરીશ."

મેલડી જેવી દિવાળી માતાએ કહ્યું કે "બહેન! બેટા વિધાવતી! મારું માન અને ઉઠ! જો તારા બાપ ગભરાય છે, તેથી આ મંગલ કાર્યમાં જરૂર અમંગળ થશે. અને તારે કે મારે કોઈને મોઢું દેખાડવા જેવું રહેશે નહીં. માટે ઉઠ અને બહાર આવ."

આમ બહુ બહુ કહ્યું ત્યારે વિધાવતી દિલગીર ચહેરે, રડતે હૃદયે નીતરતી આંખે ઊઠી અને બોલી કે, "આવું છું કરો તમારું કાળું" એમ કહી બહાર આવી પાટલે બેઠી અને ગોર ગાંડારામે ગાલપુરાણનાં ગપ્પાં ચલાવી લગ્નની વિધિ સંપૂર્ણ કરી.

વિદ્યાવતીના બળતા હૃદયની વાણી :— બીજે દહાડે જાન ચાલવા વખતે વિધાવતી પોતાનાં માતા-પિતાને એકાંતમાં બોલાવી બળતે હૃદયે આંસુભીની આંખે અને ગળગળે સાદે બોલવા લાગી, "બાપા, તમે કે મારી માએ કાંઈ મારા સુખ સામું જોયું નથી. કેવળ પૈસા સામું જોઈ મારો ભવ બગાડયો. પણ ચોક્કસ જાણજો કે દિકરીનો પૈસો લઈ તેને વેચવી એ અધમમા અધમ કામ છે. દીકરીના ધનથી કોઇ સુખી થયો નથી. દીકરીના દોકડા લઈ તેને દુઃખના દરિયામાં ધકેલી મેલે છે. તે માતા-પિતા નહિ પણ એતો પૂર્વ ભવના ખરેખરા શત્રુ છે. પુત્રીનું ધન હળાહળ ઝેર જેવુ છે. દીકરીના સુખ સામું નહિ જોતાં કેવળ પોતાનો સ્વાર્થ સાધે છે તેનું ઈશ્વર કદી પણ ભલુ કરતો નથી. તેની વંશવૃદ્ધિ થતી નથી. થઈ હોય તો પણ નિર્મુળ થઈ જાય છે. તમે સુખ માણવા અને સૌથી સવાયા થવા મનગમતા પૈસા લીધા અને મને આવા બુઢિયા સાથે પરણાવી મારો ભવ બગાડયો તે બહુ ખોટું કર્યું. આ પૈસાથી તમને સુખ નહિ થાય અને આ કૃત્યને ભગવાન નહિ સહન કરે" આમ કહી ધ્રુસ્કે ને ધ્રુસ્કે વિદ્યામતી એ રડવા માંડયું અને બોલી....

□

realpatidar.com

https://archive.org/details/bk107/page/n27/mode/1up

realpatidar.com

[૨૪]

નિર્મળ માર્ગ

—કરમશીભાઇ હ. પટેલ
નાસિક (M.S.)

સાબરમતી નદીના કિનારે નયનરમ્ય સ્થળે આવેલાં સત્પંથાચાર્યજીનો આશ્રમ (પ્રેરણા પીઠ) માં શિષ્યો, યાત્રીઓ અને જ્ઞાનાર્થી સેવકોથી હંમેશાં પુલકિત રહેતો દૂર દેશાવરથી આ આશ્રમમાં ભાવિક ભકતો અને દર્શનાર્થીઓ હંમેશા પોતાના દુઃખ હળવાં કરવા આવતા અને પરમ વંદનીય સંતપંથાચાર્યની પ્રસાદથી અને પ્રેમાલાપથી પાવન થતા. નિત્યક્રમમાં આચાર્ય સવારે ૫ વાગે પૂજન–અર્ચન કાર્ય પતાવી સતસંગની ગાદીપર બેસી સતસંગનું પાવન ઝરણું વહેતું કરતા, મધુરવાણીથી દરેક પ્રસંગ એટલી ભાવુક્તાથી પ્રગટ કરતા કે શ્રોતાજનોની આંખો પણ ભીની થઈ જતી. આવા પ્રેમાલાપથી સમય કેમ પસાર થતો તેનો ખ્યાલ પણ ન આવતો. આ સતસંગમાં આચાર્યનો માનીતો શિષ્ય એક દિવસ સતસંગ દરમ્યાન ઉભો થયો !!!

ગુરૂજીનું ધ્યાન શિષ્ય તરફ ગયું. પ્રેમભર્યા શબ્દોથી ગુરૂજી બોલ્યા : બોલ, વત્સ !! શું કહેવા માંગે છે? આમ એકાએક ઉભો કેમ થયો ?

ગુરૂજીના મોઢા ઉપર સ્મિત હતું. વાણીમાં મીઠાશ હતી. તેથી શિષ્ય તેનો પ્રશ્ન રજુ કરવાની હીંમત કેળવી બોલ્યો, ગુરૂજી ! આ દુનિયામાં અનેક ધર્મ અને પંથ છે. તેમ છતાં આપણે આ સતપંથ ધર્મ જ કેમ અંગીકાર કર્યો ? સતપંથને જ કેમ આટલું બધું મહત્વ આપ્યું ?

ગુરૂજીની આંખમાં તેજ આવ્યું હોઠ પર સ્મિત લાવી હળવા સ્વરે બોલ્યા, વત્સ ! દરેક ધર્મ સત્કાર્યો કરવાનું, વ્યસનમુક્ત થવાનું, સદાચારી રહેવાનું અને નિર્મળ મને પ્રભુ ભક્તિ કરવાનું જ સુચવે છે. તેથી કોઈ ધર્મ ખોટો છે કે ઉણો ઉતરેલો છે તેમ કહેવું અયોગ્ય છે. દરેક ધર્મ સાચા છે. સાચા અર્થમાં તેનું આચરણ કરવામાં આવે તો કોઈ ધર્મ અયોગ્ય નથી પણ જેમ રાજય-ગાદી બદલાય અને સમય સમયનું કામ કરે તેમ ભગવાન શ્રી વિષ્ણુએ અત્યાર સુધી નવ અવતાર ધારણ કર્યા છે. અને સમયાંતરે દૈત્યોને સંહારી ધર્મ ટકાવી રાખ્યો છે. તેમ વર્તમાન યુગના સ્વામી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન, વિષ્ણુના દસમા અવતારના રૂપે પ્રગટ થશે અને કળીયુગના અંધકારને ઉજાશ આપશે અને સાચા સેવકોને ઉગારવા જરૂર પધારશે !!! આ સમય છે. દસમા અવતારના સ્વામીનો, શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનો જે આપણા ઈષ્ટદેવ છે. તેનું પૂજન અર્ચન કરવાથી આપણું મન નિર્મળ અને સદાચારી બને છે. સાચા ખોટાનો ભેદ સમજાય છે. અને સ્વાધ્યાયી (નિત્ય સતસંગી) ને પ્રભુ એક જયોતિ સ્વરૂપે હંમેશાં પ્રેરણા આપતા રહે છે. સુખમાં ધીરજ અને નિર્મળ બનાવે છે. દુઃખમાં સહનશીલતાનો સંચાર કરે છે. પ્રભુ અકળ છે. તમામ વસ્તુમાં સમાયેલો છે, પવન, પાણી, પાન, ફૂલ દરેકે દરેક વસ્તુમાં તેનો સૂક્ષ્મ સંચાર છે. !

અને બેટા ! સતસંગીથી વ્યસનનો વિકરાળ રાક્ષસ હંમેશા દુર રહે છે. અને આવા અવિચારી રાક્ષસ સામે પ્રભુ હંમેશાં અદૃશ્ય કવચરૂપે રક્ષણ પુરૂ પાડે છે. તેથી ધર્મી હંમેશાં નિર્ભય બનતો જાય છે.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n28/mode/1up

realpatidar.com

ગુરૂજીના આપેલા આશ્વાસનીય જવાબથી શિષ્ય સતપંથી ગદ્‌ગદ્‌ થઇ ગયો. અને સર્વ સતસંગીના મનનું પણ સમાધાન થયું. છતાં શિષ્ય સતપંથીને બીજો સવાલ મુંઝવી રહ્યો હતો, તે ફરી પાછો ઊભો થયો નજર જુકાવી ધીમા સ્વરે બોલ્યો ગુરૂજી ! આ માયાજાળ સંસારમાં રહીને માનવી સદાચારી અને સતસંગી કેમ બની શકે ?

ગુરૂ સતપંથાચાર્યજી ધીમુ હાસ્ય કરી, ઢાળેલી આંખો નિર્મળ મને ઉંચી કરી, શિષ્ય સતપંથીની આંખોમાં આંખ પરોવી પ્રેમથી બોલ્યા, વત્સ....બેટા. રાજા હરિશ્ચન્દ્ર, શીબીરાજા, શેઠ સગાળશા, ગોરો કુંભાર, સંત નથુરામબાપા, જલારામબાપા અને સતપંથનું જ્ઞાન આપનાર આપણા સતપંથના ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ પણ સંસારી હતા. પણ સંસારની માયાજાળ તેને લોપી શકી નહીં. કારણ તે નિત્ય સતસંગી, સદાચારી, અને નિર્મળ મને પ્રભુ ભક્તિ કરનાર તેજસ્વી પુરૂષ હતા. અને આજે પણ આપણે આદર અને પૂજ્ય ભાવથી તેનું રટણ કરીએ છીએ. તેમ માનવી સંસારમાં રહીને પણ તેના આચાર-વિચારોથી ત્યાગી અને સેવાભાવી સતપંથી બની શકે છે. તેના માટે આત્મબળ કેળવવું જરૂરી છે. સંસારમાં રહેલા માનવીનો પહેલો ધર્મ છે. માતા-પિતાની સેવા, ગુરુજીના વચનનું પાલન અને સંસારની માયાજાળમાંથી સમય કાઢી, પ્રભુ સ્મરણ કરવુ. તેમાં માતા-પિતાએ આપણને જે લાડકોડથી ઉછેરી મોટા કર્યા. તેના બુઢાપાની લાકડી બની તેને સહારો આપવાની જવાબદારી પુત્રની રહે છે. માતા-પિતાની લાગણીને ઠેસ ન પહોંચે અને દિલ ન દુભાય અને તેની જે બને તે સેવા કરવાની ફરજ દરેક પુત્રની છે. માતા પિતાએ આપેલા લાડકોડનો ત્રીજો ભાગ પણ પુત્ર અદા કરી શકે તોય પુત્ર માતા-પિતાના ઋણમાંથી મુકત થઈ શકે. અને બેટા ! માતા-પિતાના ચરણોમાંજ સુખ સમાયેલું છે તેમ કહેવું પણ વધારે નહીં ગણાય.

અને આપણા ગુરૂ અનંતના ભરણામાં આપણી પડખે ઉભાં હશે. અને આપણા વતી ભગવાન સામે આજીજી કરી આપણા દુસ્કૃત્યોની ક્ષમા માગશે. તેથી આપણી પણ ફરજ છે. કે ગુરૂજીએ જે રાહ બતાવ્યો છે. આપણને ધર્મનું જ્ઞાન પુરૂં પાડયું છે- અને જે સદ્‌માર્ગ સૂચવ્યો છે. અને જે ગુરૂમંત્ર આપ્યો છે. અને તે ગુરૂમંત્રનું આપણે નિત્ય રટણ કરીશું તોય ગુરૂજી આપણી રક્ષા કરશે અને ગુરુ મંત્રને જ હંમેશાં 'મહામંત્ર' કહ્યો છે. અને મહાંયત્ર પર વિશ્વાસ રાખી તેનું રટણ કરવું જ શિષ્યની ધાર્મીક ફરજ બને છે, મંત્ર નાનો કેમ ન હોય પણ તેનું મહત્વ અનેક ઘણું વધી જાય છે. જ્યારે તેનું આપણે ગુરૂમંત્ર દ્વારા ગ્રહણ કરીએ છીએ. અને ગુરુજીએ આપેલા જ્ઞાનનો આપણે હંમેશાં સદ્‌ઉપયોગ કરવો તેમાંજ ગુરુજીનું ઋણ અદા કરવામાં આપણે સફળ થઈ શકીશું.

આટલું સાંભળી શિષ્ય સતપંથીનું મન હલકું થઈ ગયું ગુરૂજીના ચરણે માથું જુકાવી નમ્ર સ્વરે બોલ્યો ગુરુજી મને ગર્વ છે કે મને તમારા ચરણોમાં સ્થાન મળ્યું છે અને શિષ્યના રૂપમાં તમે મારો સ્વિકાર કર્યો છે. આટલું કહેતાં તેની આંખો ભીની થઈ ગઈ. આ દૃષ્ય જોઈ હાજર શ્રોતાજનોની પણ આંખો ભીની થઈ ગઈ. ગુરુજી હળવેથી ઉભા થઇ સર્વ સતસંગી સામે હાથ જોડી પ્રણામ કરી બોલ્યા ભાઈઓ હવે આપણે આવતી કાલ સતસંગમાં મળીશું.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n29/mode/1up

realpatidar.com

સૌને મૂંઝવતો સવાલ : ત્યારે જીવવું કઈ રીતે ?

— અરવિંદ એસ. પટેલ
(વડાગામ)

અત્યારના સમયમાં, ચાલુ વર્તમાનકાળમાં સૌને મૂંઝવતો એક પ્રશ્ન છે. ત્યારે જીવવું કેમ ?

જ્યાં નજર નાખોય ત્યાં દેખાય છે ઉતાવળ, દોડાદોડી અનિશ્ચિતતા, અશાંતિ, અસંતોષ, અવિશ્વાસ, ઉગ્રતા. માનસિક તણાવ અને ચિંતા. ઘરમાં અશાંતિ, ઓફિસમાં અશાંતિ, શાળામાં અશાંતિ, કોલેજમાં અશાંતિ, સર્વત્ર અશાંતિ, જાણે સૌને માનસિક અશાંતિનો રોગ લાગુ પડયો છે. પિતા–પુત્રના સંબંધો, શેઠ–નોકર વચ્ચેના સંબંધો, ગુરુ–શિષ્યના સંબંધો, અધિકારીને કર્મચારી વચ્ચેના સંબંધો, શાસક અને પ્રજા વચ્ચેના સંબંધો સર્વત્ર અવિશ્વાસ અને વ્યગ્રતા દેખાય છે.

તવંગર કે ગરીબ બંનેની સ્થિતી સરખી છે. બંને ચિંતા અને અશાંતિના સરખા ભોગ બન્યા છે. પૈસામાં સુખ નથી, ગરીબીમાં સુખ નથી તો શું જગતમાં સાચા સુખ શાંતિ હશે ખરાં ? તેનો કોઈ ઉપાય હશે ખરો ? ગરીબની ફરિયાદ છે કે જીવન હાડમારી ભર્યું છે. ધનિકની ફરિયાદ છે કે વાડી, ગાડી, બંગલા, પૈસા બધું જ છે, પણ મનને ક્યાંય શાંતિ નથી. ક્યારેક ઘણાંને એમ થતું હશે કે ભગવાને આવો દુઃખમય સંસાર કેમ સર્જ્યો હશે ? છેવટે ભગવાનને દોષ.

બધા રોગોનું મૂળ આપણી અંદર પડેલું છે. અને આ બધા આપણા મનના ઉધામા છે. આપણે જીવન જીવીએ છીએ ખરા, પરંતુ જીવન તરફની આપણી દૃષ્ટિ જ ખોટી છે. આજનું આપણું જીવન કૃત્રિમ બની ગયું છે, અને આપણી મર્યાદાઓ બહાર આપણે જીવવું છે. હું કેવો અને કેટલો મોટો માણસ છું, તેનો આડંબર જ બતાવે છે, અને દેખાદેખી કરીને, આંધળું સમજ્યા વગરનું અનુકરણ કરવું છે, અને હું કેવો લાગું છું, જેવી સામાન્ય બાબતમાં પણ બીજાના અભિપ્રાયના સર્ટીફિકેટની અપેક્ષા રાખવી છે. આવી બધી જ બાબતોમાં બન્યું છે. અને પછી રોદણાં રોવાં છે. પરસ્પર વિશ્વાસ ઉઠી ગયો છે. આપણે પોતે જ અધૂરાં છીએ. અને પારકી પંચાતમાંથી નવરા પડતા નથી આમ અશાંતિને આપણે જાતે ઉભી કરીએ છીએ. અને પછી નીકળીએ છીએ શાંતિની શોધમાં.

શાંતિની ગુરૂ ચાવી આપણી અંદર જ છે. ફક્ત આપણો દૃષ્ટિકોણ જ બદલવાની જરૂર છે. ભૌતિક રીતે જે આપણાથી આગળ છે, સુખી વર્ગ છે તેના તરફ. જે દ્રાષ્ટ રાખીએ છીએ પરંતુ જો આ દૃષ્ટિ, આપણાથી ગરીબ વર્ગ છે તેના તરફ રાખવામાં આવે તો જરૂર સંતોષ મેળવી શકાય, સંતોષમાં પરમ સુખ, પરમ શાંતિ રહેલો છે તે સત્ય આપણે સ્વીકારવા તૈયાર નથી.

આમ આપણા જીવનમાં રહેલી અશાંતિ અને વ્યગ્રતા દૂર કરવા પ્રારબ્ધ અને પુરૂષાર્થનો સમન્વય કરતાં શીખવું જોઈએ. તેમજ સત્યનું પૂરેપુરૂ આચરણ ન થાય તો ભલે પરંતુ બુરૂ તો ન જ કરીએ, પુણ્ય ન થઈ શકે તો ભલે પણ પાપાચારથી દૂર જ રહીએ. દંભથી આપણે ઘેરાઈ ગયા છીએ તેથી સરવાળે ખોટ આપણને જ છે તો તેવા દંભનો ત્યાગ કરીએ. આમ શાંતિમય જીવન જીવવા માટે થોડાક સિદ્ધાંતો અપનાવીશું તો જરૂર સાચું સુખ મેળવી શકીશું.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n30/mode/1up

realpatidar.com

(૧) હંમેશાં રાત્રે સૂતાં પહેલાં દિવસભરની પ્રવૃત્તિઓ ઉપર દૃષ્ટિ કરી જવી, સારાંનો સરવાળો કરવો અને ખરાબની બાદબાકી કરવી.

(૨) હંમેશાં નિયમિત ધ્યાન અને પ્રાર્થના કરવી.

(૩) ઇશ્વરમાં શ્રદ્ધા રાખવી તેમજ હંમેશા સદ્‌પુસ્તકોનું વાંચન કરવું.

(૪) ભાગ્યનું ચણતર કર્મના પાયા ઉપર રહેલું છે, માટે હંમેશાં સારાં કર્મ કરવાની કાળજી રાખીએ.

(૫) કોઇના દોષ અવગુણ ન જોતાં તેના સદ્‌ગુણો ગ્રહણ કરવા તેમજ ઇર્ષાવૃત્તિ તથા અહંકારનો ત્યાગ કરીએ.

(૬) આપણા ચારીત્ર્યને દાગ લાગવા ન દઇએ શુદ્ધ ચારિત્ર એજ મહાન શક્તિ છે.

(૭) લક્ષ્મી પાછળ આપણે ન દોડીએ, પણ એવા સદ્‌ગુણો કેળવીએ કે જેથી લક્ષ્મીજી દોડતાં આવે.

(૮) "ભોગવો તો ભાગે, ત્યાગો તો આગે" એને અનુસરીને ત્યાગવૃત્તિ કેળવીએ.

આમ થોડા સદ્‌ગુણો અપનાવીશું તો બીજા ઘણા ગુણો આવવા લાગશે અને જીવન જીવવા જેવું લાગશે. અને પછી ક્યારેય એ સવાલ નહિ થાય કે..."ત્યારે જીવવું કઈ રીતે".

જયશ્રી ગુરુ ગાદીપતિ
જયશ્રી સતપંથ સમાજ

ક્યાં જઈએ શું કરીએ, મનમાં ઘણો સંતાપ
નમન કરીએ સતપંથને, ધન્ય પિરાણા ધામ.
પરમ પુનિત આ ધામ ગામ પિરાણા
ગુરુ ગાદી પતિ, ગુરુ શ્રી કરસનદાસ.
તવ આશીષે, તવ ચરણોમાં શીષ નમે સુખ થાય.
આપ અમારા ગુરુ ગંગા છો સરસ્વતિ સમ યમુના છો.
જ્યાં નિષ્કલંકી નારાયણ, શીતલ ચન્દ્ર સમાન.
આપ થકી રસ ભક્તિનો, થાય અમોને ભાષ.
આસ અધુરી અમ તણી, પુર્ણ કરો ગુરુ મહારાજ.
જય શ્રી ગુરુ મહારાજ, જય શ્રી કરસનદાસ.
તમ સાનિધ્યમાં શોભી રહ્યું, આ મંદિર સંકુલ વિશાળ.
જ્ઞાન, ધ્યાન, ભક્તિ, શ્રદ્ધા ગુણ થકી, ગુરુ ગાદી સુવર્ણ સમી.
પ્રકાશી રહ્યા છો, આપ ધામ શોભાવી રહ્યા છો.
વંદન (૨) શ્રી ગુરુ મહારાજને, વંદન પિરાણા ધામ.
વંદન કરીએ ગુરુદેવને, સફળ તિરથ સુખ ધામ.
જય શ્રી ગુરુ ગાદીપતિ, જય શ્રી કરસનદાસ.
ઓમ શાન્તી, શાન્તી, શાન્તી....

–રતિલાલ બી. રાવળ ખેડોઇ–કચ્છ

realpatidar.com

https://archive.org/details/bk107/page/n31/mode/1up

realpatidar.com

એક નાનકડો લેખ–

સંત હૃદયની નિર્મળતા

–કુ પ્રેમિલા એન પટેલ
રવીપુરા (ઇડર)

સંત દાદુ સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતાં હતાં. તેમની સુવાસ ચોતરફ પ્રસરેલ હતી અને તેની આજુબાજુના કેટલાય દુઃખી જીવોને માર્ગદર્શન, મદદ અને સલાહ આપતા. તેમની આવી પરોપકારી પ્રવૃત્તિથી લોકોએ તેમનો પીછો ન છોડયો અને તેમને સતત વ્યસ્ત કરી દીધા. સતત વ્યસ્ત રહેતા હોવાથી દાદુ કંટાળ્યા કે આ તો પ્રભુભક્તિમાં સમય જ મળતો નથી એટલે વિચાર્યું કે લાવ અહીંથી હું જંગલમાં જતો રહું અને એકાંત મળે તો પ્રભુ ભજન કરું. આ સંત દાદુ એક દિવસ પોતાનું ગામ છોડીને જંગલમાં ચાલી નીકળ્યા. યોગ્ય સ્થાન જોઈ તેમણે એક ઝૂંપડી બનાવી અને તેમાં નિવાસ કર્યો.

પરંતુ સંત હૃદય! તેમને થયું ગામમાં હતો ત્યારે તો લોકોને મદદ કરતો, માર્ગદર્શન આપતો, પણ આ જંગલમાં તો કંઈ જ કરવાનું નહિ. એમને થયું કે લાવ આ રસ્તા પર જે ઘાસ ઊગ્યું છે તે દરરોજ થોડું થોડું સાફ કરી અને રસ્તો ચોખ્ખો કરું જેથી વટેમાર્ગુઓને પગમાં તકલીફ ન થાય. એટલે દાદુએ દાંતરડુ લઈને રસ્તો સાફ કરવાનું શરુ કર્યું.

એક દિવસ આ પ્રમાણે તેઓ રસ્તો સાફ કર્યા કરતા હતા. ત્યારે તેઓ જે ગામમાં રહેતા હતા તે ગામની બાજૂના ગામના કોટવાળને સંત દાદુના દર્શન કરવાની ઇચ્છા થઇ અને દાદુ સાહેબને શોધતો શોધતો જંગલમાં આવ્યો અને દાદુ સાહેબ પાસે આવીને ઊભો રહ્યો. કોટવાળે દાદુને ક્યારેય જોયેલા નહિ એટલે આવીને પૂછયું કે, દાદુ સાહેબનો આશ્રમ ક્યાં છે? તેમની કાંઈ ખબર છે? પણ દાદુ મૌન જ રહ્યા. અને પોતાનું ઘાસ કાપવાનું કામ ચાલું જ રાખ્યું.

પેલા કોટવાળે ફરી પ્રશ્ન કર્યો પણ દાદુ નિરુત્તર રહ્યા. પેલાએ સતત અડધો કલાક સુધી દાદુ સાહેબ વિશે પુચ્છા કરી પણ દાદુ પોતાના કાર્યમાં વ્યસ્ત જ રહ્યા. એટલે કોટવાળને થયું આ કોઈ ગાંડો માણસ છે હું ક્યારનોય પૂછું છું અને આ જવાબ જ આપતો નથી. એટલે તેને ગુસ્સો ચડયો. તેને ઘોડાને મારવાના ચાબુકથી સંત દાદુ પર પ્રહાર કરવા માંડયા. કોટવાળે સંત દાદુને સાત ચાબુક માર્યા એટલે સંત દાદુ ગબડી પડયા. પેલો કોટવાળ થાકીને ત્યાંથી ચાલી નીકળ્યો. એકાદ માઈલ દૂર ગયો હશે ત્યાં પેલાં કોટવાળને એક માણસ સામો મળ્યો. તેને પ્રશ્ન કર્યો કે, 'તમે દાદુનો આશ્રમ કે નિવાસ જાણો છો?'

પેલાએ કહ્યું, 'તમને રસ્તામાં ન મળ્યાં! 'રસ્તામાં ક્યાં'? મુસાફરે કહ્યું. 'તમે જે રસ્તે આવ્યા ત્યાં કોઈ ઘાસ કાપીને રસ્તો સાફ કરે છે તે મળ્યા?'

કોટવાળને થયું ઘાસ કાપીને રસ્તો સાફ કરે છે તે સંત દાદુ હતા? તેની આંખોમાં પાણી આવી ગયું. મનોમન ખુબ દુઃખી થયો અને મુંઝાયો કે મેં આ શું કર્યું? નીકળ્યો હતો ગુરુ કરવા અને કરી બેઠો સંતદ્રોહ! તેણે ઘોડાને તરત જ પાછો વાળ્યો અને સંત દાદુ જ્યાં ઘાસ કાપતા હતા ત્યાં ઊભો રહ્યો ઘોડા પરથી નીચે ઊતરી દાદુ સાહેબના પગ

realpatidar.com

https://archive.org/details/bk107/page/n32/mode/1up

realpatidar.com

પકડીને ક્ષમા માગવા લાગ્યો કે મેં આપનો અપરાધ કર્યો છે. હું આપને ઓળખી ન શક્યો અને આપને દંડ દઈ બેઠો.

સંત દાદુએ સહજભાવે કહ્યું, 'ભાઈ તે બહું સારૂં કર્યું' માણસ માટીનું માટલું લેવા બજારમાં જાય ત્યારે તેના પર ટકોરા મારી મારીને માટલાની પરીક્ષા કરે છે. આ માટલું બોદું તો નથીને? કાંણુ તો નથી ને ? મારા પૈસા પાણીમાં તો નહિ જાય ને? તો આ તો કળિયુગ છે ભાઈ એમાં ચાબુક માર્યાં વગર ગુરુ કરાય જ નહિ. મારા શરીરને ચાબુકના ઘા તો રુઝાઈ જશે, પણ તું અંધશ્રદ્ધાથી ગુરુ કરે, પછી તારી શ્રદ્ધા પર ઘા પડે એની રુઝ આવવી કઠિન છે. માટે પારખીને જ ગુરુ કરવા જોઈએ. આવી હતી સંત હૃદયની નિર્મળતા!

માતૃ ભકત જ્ઞાનેશ્વર

—અમૃતલાલ ડી. પટેલ સુરત

સંત જ્ઞાનેશ્વર માના પરમ ભકત હતા. તેઓ બીજી કોઈ માના નહીં, પોતાની જ માતાને પૂજતા, સેવા કરતા, આજ્ઞામાં જ રહેતા. એકવાર માની તબિયત બગડી, જ્ઞાનેશ્વર સર્વસ્વ ભૂલી તન-મન-ધનથી માની સેવા કરવા લાગી ગયા.

તેઓ જાણુતા હતા કે જગતમાં "મા" એક અક્ષરનો શબ્દ છે. પરંતુ એ કેટલો મહાન છે, અમૂલ્ય છે. તેનું મૂલ્ય તેમને મન મહાન હતું અને કહ્યુ છે કે 'મા એ મા,' બાકીના બધા વગડાના ખોટા વા,' વળી જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ. એ પંકિત આ વાતની પૃષ્ટિ કરે છે. માના જવાથી માનવ એક જાતની બેચેની, અપૂર્ણતા અનુભવે છે. માના આશીર્વાદથી સંતોષપૂર્ણ જીવે છે. એટલેજસ્તો જ્ઞાનેશ્વરને મન "મા" એ દુનિયાનું સર્વસ્વ હતું. બિમાર માને દવા પીવડાવી સૂવાડયા. થોડીવારે માએ પાણી માંગ્યું, તે લેવા રસોડે ગયા, લઇને આવ્યા ત્યારે મા ઊંઘી ગયા હતા. તેઓ ત્યાં જ ઊભા રહ્યા, બેસે તો ઊંઘ આવી જાય. મા જાગે તેને પાણી પીવું હોય પણ હું ઊંઘ્યો હોઉં તો ઉઠાડે નહીં. એટલે ખડે પગે સંત્રી પહેરાની જેમ ઊભા જ રહ્યા. જંગલની સરસ જડીબુટ્ટી લાવી, વાટીઘૂંટીને પીવડાવવાથી માને આખી રાત સરસ ઊંઘ આવી, તે જોઈ જ્ઞાનેશ્વર તૃપ્ત થતા હતા. સવારે માએ આંખ ખોલી, જોઉં તો જ્ઞાનેશ્વરના હાથમાં પાણીનો ગ્લાસ!!! માએ કહ્યું. બેટા, તેં કેટલી તકલીફ લીધી. આખી રાતનો ઉજાગરો કર્યો ?'

જ્ઞાનેશ્વર બોલ્યા, તેં મને મોટો કરવા કેટલી તકલીફો લીધી છે, કેટલા બધા ઉજાગરા કર્યા છે, તે લખતા શાહી ખૂટી જાય તેમ છે. તારા ઉપકારો શબ્દોથી પૂરા થાય તેમ નથી. તારી અનેક રાતોની તકલીફો આગળ આ એક રાત તુચ્છ છે. આવી હતી સંત જ્ઞાનેશ્વરની માતૃભક્તિ.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n33/mode/1up

realpatidar.com

આપણે કોઈ દિવસ જ્ઞાન લેવા ગયા છીએ !

—એન. કે. પટેલ
નીચીધનાલ (ખેડબ્રહ્મા)

આપણે સાચા અર્થમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે–જ્ઞાન લેવા માટે જતા જ નથી. મોરારી-બાપુની રામાયણ કથામાં કે આશારામ બાપુની સત્સંગ કથામાં કે અન્ય સાધુ સંતોની જ્ઞાનવર્ધક કથાઓમાં આપણે અનેકવાર ગયા હોઈશું અને તક મળે હજુ પણ જવાનું વિચારીશું. પરંતુ આપણે જો અંતઃકરણપૂર્વક આપણા મનડાને ઢંઢોળીને પોતાની જાતને સાચા દિલથી પ્રશ્ન પૂછીશું કે ઉપરોક્ત કથા–સત્સંગોમાં શું ખરેખર આપણે જ્ઞાન લેવા ગયા છીએ ? મારા મત મુજબ જવાબ મળશે. 'ના' કારણ કે ત્યાં કદાપિ આપણે જ્ઞાનમય બનવા માટે જતા નથી, માત્ર દેખાવ કરવા અથવા સંબંધીઓના આગ્રહને વશ થઈને અગર તો મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવા જતા હોઈએ છીએ. જીવ તો ઘર, દેવ, ધન–વૈભવ, માતાપિતા, સ્ત્રી. પુત્રાદિકમાંથી આસક્તિ છોડી શકતો નથી. પછી જ્ઞાન મેળવવાનો અવકાશ ક્યાંથી રહે ? નીચેના સાદા–સરળ દૃષ્ટાંત દ્વારા વધુ સ્પષ્ટતા થશે.

એક ભાઈ બજારમાં ઘઉં લેવા માટે ગયા. પરંતુ ઘઉં ભરવા માટે કોથળો સાથે લીધા વગર ખાલી હાથે ગયા. વેપારી તરત સમજી ગયો કે આ ભાઈ ઘઉં લેવા આવ્યા નથી. માત્ર ભાવ પૂછવા આવ્યા લાગે છે. જ્યારે પેલા ભાઈ દ્વારા ઘઉંના ભાવનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે વેપારીએ ચતુરાઈ વાપરીને બજારભાવ મણનો એંશી રૂપિયા ચાલતો હતો. તેના બદલે બે રૂપિયા ઓછા એટલે કે ઈઠોત્તેર રૂપિયા કહ્યા. કારણ કે આ માણસ ખરેખર ઘઉં લેવા માટે નીકળ્યા નથી, પછી આ ભાઈએ બજારની બીજી ત્રણ ચાર દુકાનોએ ભાવ પૂછી જોયા તો ત્યાં એંશી રૂપિયાનો ભાવ કહ્યો. એટલે ભાઈને વિશ્વાસ બેસી ગયો કે પહેલા વેપારીની દુકાને જ વ્યાજબી ભાવે ઘઉં મળે છે.

થોડા દિવસ પછી જ્યારે આ ભાઈ હાથમાં કોથળો લઈ ખરેખર ઘઉં લેવા ગયા ત્યારે વેપારી સમજી ગયો કે આ વખતે આ માણસ ઘઉં લઈને જ જવાનો છે. એટલે તેણે મણના બ્યાસી રૂપિયા ભાવ બતાવ્યો આ ભાઈએ પૂછયું કે કેમ શેઠ ? અઠવાડિયા પહેલાં તો તમે ઈઠોતેરનો ભાવ કહેતા હતા અને હવે આજે બ્યાસી કેમ માગો છો ? તો પેલા વેપારીએ મીઠાસથી હસીને જવાબ આપ્યો કે ભાઈ, ઈઠોતેરના ભાવના ઘઉં તો વેચાઇ ગયા અને હવે બે–ત્રણ દિવસથી માલની અછત અને ખેંચને લીધે ભાવ વધી ગયા, એટલે પેલા ભાઈ આ વેપારીના અગાઉના વિશ્વાસમાં તણાઈને બે રૂપિયા ઠગાઈને ઘઉં લેતા આવ્યા.

ઉપરના દૃષ્ટાંત ઉપરથી સમજી શકાય કે જ્ઞાન લેવા જઈએ ત્યારે પણ આપણી પાસે વૈરાગ્યથી નિર્મળ થયેલું અંતઃકરણરૂપી શુદ્ધ પાત્ર જોઈએ. જ્યાં સુધી અંતઃકરણમાં અનેક કામનાઓનો અને વાસનાઓનો વાસ થયેલો છે અને તેનો કાટ ચઢેલો છે ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન થવું અશક્ય છે. કારણ કે કોટિ–કોટિ ઉપાય કરીએ તો પણ વૈરાગ્ય વિના જ્ઞાન ટકતું નથી. અને અંતે....

Short and Sweet :–સિંહણના દૂધ માટે સોનાનું જ પાત્ર જોઈએ.

realpatidar.com

□

https://archive.org/details/bk107/page/n34/mode/1up

realpatidar.com

'સ્ત્રી–રત્ન'

—સરલા પી. પટેલ
લખેડા (ઇડર)

[વર્ષોથી સમાજમાં સ્ત્રીઓ માટે વિવિધ કલ્પના પ્રવર્તે છે. આજે સ્ત્રી કયાં આવીને ઉભી છે. તે નજરે નિહાળશું.]

સ્ત્રી : મને જોતાં જ તમને પ્રશ્ન થશે કે હું કોણ છું તમે મને નહીં ઓળખી શકો. અરે, નથી ઓળખી શકયા અને નથી ઓળખી શકવાના. આ મારો આક્ષેપ નથી પણ હકીકત [j] છે. આ પ્રશ્ન કંઈ આજનો નથી અનાદિ કાળનો છે.

હા, આ વિશ્વમાં બે મહાન શક્તિઓને હજી સુધી કોઈ ઓળખી શકયું નથી. જાણો છો તમે એકનું નામ તે ઇશ્વર અને બીજી તે હું સ્ત્રી. કોણે સ્ત્રીને ઓળખી છે, કહો તો જરા ? કોણે આ સ્ત્રીત્વને અનુભવ્યું છે. ના, કોઇએ જ નહીં...જો પહેલેથી જ કહ્યું હતું ને કે તમે મને નથી ઓળખી શકયાને નથી ઓળખી શકવાના.

હા, તમે મને સુંદર અને છેતરામણા શબ્દો વાપરીને ઊંચા આસને બેસાડી છે....કેવા આસવાક શબ્દો છે.

નારી તું નારાયણી ગૃહણી ગૃહશ ઉજ્યાયતે,
પત્ર નાર્યસદ્ર પૂજનત્ને રમનો નત્ર દેવાના.

અરે વાહ–વાહ પણ આ બધું વ્યવહારમાં કયાંય છે ? અરે માતૃદેવો ભવ કહેનાર માતાને વહુ આવતાં જુદી કાઢી મૂકે છે. અરે પત્નીને પણ પ્રેમ કરી શકતો નથી. તેનેય સળગાવી મૂકે છે, રીબાવે છે, મારકૂટ કરે છે. અરે મારી નાંખે છે. છોકરા અને છોકરીઓમાં ભેદ અને છોકરી જન્મતા હાયવોય હાયવોય કરી મૂકે છે. સ્ત્રીને તે શોભે છે ? ગોટલાની જેમ ફેંકી દે છે. દહેજના ખપ્પરમાં કંઈ કેટલીયે હોમાઈ ગઈ અને કેટલીયે હોમાશે.

પુરૂષના બહુગામી વૃત્તિને કોણ ઓળખી શકયું છે. ઇતિહાસ એટલે સ્ત્રીઓ પરનો થતો જુલ્મનો ઇતિહાસ સાંભળો આ તમારો ઇતિહાસ.

સીતા : (ભ્રાંત) હા હું એજ સીતા રાજા રામની પત્નિ, અશોક વાટિકાની મારી અગ્નિ પરીક્ષા ? મને કેવી અવસ્થામાં ઘોર જંગલમાં એકલીને ત્યાગી દીધી. મારો શું વાંક, મારો શું ગુનો ? ? આખરે ધરતીમાં સમાઈ જવાનું પણ મારે જ.

હા....હું શકુંતલા : આશ્રમની તાપસ્ત કન્યાને હું શકુંતલા જ્યારે સગર્ભા અવસ્થામાં રાજસભામાં ગઈ ત્યારે એ રાજા દુષ્યંતે મને શું કહ્યું હતું ? તે યાદ છે ? હું તને નથી ઓળખતો !! ...તે ના જ ઓળખે ને ? કોણે મને ઓળખી છે કે એ મને ઓળખે !!

દ્રૌપદી : યુધિષ્ઠિરે જુગાર રમી અને હોડમાં મૂકી. સૌની આંખ સામે નિર્વસ્ત્ર કરવા મને કેટકેટલી રિબાવી છે. દુઃશાસને મારા કાયર પતિઓ અને ભિષ્મ દ્રોણ જેવા પણ કાંઈ ના બોલ્યા. મા ગાંધારી મારી મદદે આવી. એક સ્ત્રીએ સ્ત્રીની લાજ બચાવી.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n35/mode/1up

realpatidar.com

કૃષ્ણ ભક્તિ કરનાર મેવાડની મીરાંને શું આપ્યું ? હળાહળ ઝેર જ ને?
સત્યવાદી કહેવડાવવા માટે હરિશ્ચંદ્રે મને (તારામતી) વેચી દીધી.
અહલ્યાને તેના પતિએ શલ્યા પથ્થર બનાવી દીધી.
મને શું શું નથી બનાવી. તમે જવા દો એ બધી કલંકની વાતો.
અન્યાયમાં ખંડાતી ખુદાતી તે જ હું સ્ત્રી છું.
સંવેદનમાં સંબંધોની હું કબર છું.
સતત સળગ્યા કરતું નગર છું.
યુગોથી અવગણાયેલી હું ખબર છું.
માયા, મમતા, સ્નેહ, પ્રેમ, ધીરજ, સહનશીલતા, કરૂણા બધું જ મારામાં છે.
પણ....મને કોઈએ ના ઓળખી....મને કોઈએ ના ઓળખી....!!!

અનમોલ વચન—

લીલાબેન જયન્તિભાઈ પટેલ
અજારી પટેલ ફારમ (રાજસ્થાન)

- ઇશ્વર કો પાને કા મુખ્ય સાધન ગુરુ હૈ.
- શ્રેષ્ઠ પુરૂષો કી કિર્તિ કા મુલ કારણ ધર્મ હી હૈ.
- સંતો એવં સજ્જનોકી સંગતિ વ્યર્થ નહીં જાતિ.
- સચ્ચા ઓર અક્ષય સુરત આત્મપ્રાપ્તિ મેં હી હૈ.
- વિશ્વાસ જીવન હૈ, સંશય મોત હૈ.
- સચ્ચા સ્વર્ગ માતા-પિતા કે ચરણો મે હી હૈ.
- આપકે હાથો સે જીતના ધન સત્કર્મ મે ખર્ચ હોતા હૈ ઉતના ધન આપકા હૈ.
- જીનકા મન ધર્મરત હૈ ઉનકો દેવ ભી નમસ્કાર કરતે હૈ
- બિના વિવેક કા જીવન બિના બ્રેક કી ગાડી હૈ.
- ક્રોધ કો પ્રેમ સે, પાપ કો પુણ્ય સે, લોભ કો દાન સે, અસત્ય કો સત્ય સે જીત લો.
- સદ્‌ગુરુ કી આજ્ઞા કા પાલન સર્વ કાર્યો મે સફલતા કી પૂંજી હૈ.
- સત્સંગી માતા બાલક કી શિક્ષા એવં સંસ્કારો કી ગુરુ હૈ.
- સદ્‌ગુરુ કે વચનો મે વિશ્વાસ અમરત્વ કે દ્વાર કી મુખ્ય કુંજી હૈ
- જો શિક્ષા સ્વતન્ત્રતા ઓર મોક્ષ પ્રાપ્ત નહી કરાતી ઉસ શિક્ષા કો ધિક્કાર હૈ.
- મનુષ્ય હી પરમાત્મા કા સર્વોચ્ચ મંદિર હૈ.
- સદ્‌ગુરુ સે અધિક તીનો લોક મેં કોઈ નહી હૈ.
- સાંસારિક ચીજો મે સુખ કી ખોજ કરના વ્યર્થ હૈ.
- સાજ ઉસીકા હૈ જો બજાના જાનતા હૈ.
  ગીત ઉસીકા હૈ જો ગાના જાનતા હૈ.
  જીવન ઉસીકા ધન્ય હૈ જો જીના જાનતા હૈ.
  પરમાત્મા ઉસીકા હૈ જો પાના જાનતા હૈ.

realpatidar.com

https://archive.org/details/bk107/page/n36/mode/1up

realpatidar.com

* શિબિરાર્થીઓને અભિનંદન *

વ્હાલા શિબિરાર્થીઓ...

આ વર્ષે તા. ૧૨-૧૧-૯૪ થી તા. ૧૭-૧૧-૯૪ સુધીમાં શ્રી ઈમામશાહ મહારાજની કૃપાથી કચ્છ માનકૂવા ખાતે સંસ્કારધામમાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના જય નાદ સાથે શ્રી સતપંથ બાલ-બાલિકા સંસ્કાર શિક્ષણ શિબિરનું સુંદર આયોજન થયું તેમાં તેઓએ શિસ્તબદ્ધ રીતે શિક્ષણ અને જ્ઞાનનું ભાથું મેળવ્યું તેમજ સતપંથનો અણમોલ સંસ્કાર વારસો અને મંત્રો-આરતી-પ્રાર્થના-ગુરુ વંદના-શિક્ષાપત્રી વગેરેને કંઠસ્થ કર્યા છે. તે અને પ્રતિજ્ઞા પત્ર મુજબ સ્વીકારેલી પ્રતિજ્ઞાઓનું પાલન કરશો. શિબિરમાંથી મેળવેલ સાચી મુડી ભુલાઈ ન જાય તેમજ ક્યાંય કુ-સંસ્કારોની માયાજાળમાં છીનવાઈ ન જાવ તે માટે સતપંથના મંત્રો અને સુસંસ્કારો દ્વારા જીવનને પ્રફુલ્લીત બનાવશો.

મંત્રો-પ્રાર્થના-આરતી-ગુરૂવંદના-શિક્ષાપત્રી વગેરે કંઠસ્થ કરવાનો અભ્યાસક્રમ ગત શિબિરમાં પુરો થાય છે. તો શિખ્યા વગરના મંત્રો, પ્રાર્થના, આરતી વગેરે, નિત્ય પ્રાર્થના પાઠમાંથી ઘેર બેઠાં તૈયાર કરવાના રહેશે. અને આગામી શિબિરના અભ્યાસક્રમમાં એક કદમ આગળ વધીશું તેમાં સતપંથ ધર્મ શું છે? અને સતપંથ ધર્મની ફલશ્રુતિ વિશે સમજાવવામાં આવશે.

અંતમાં સદ્ગુણો અને પ્રતિજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરજો. નિડર બની સતપંથના રાહ પર ચાલવા માટે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન સૌને પ્રેરણા અને સદ્બુદ્ધિ આપે એજ શુભ આશીર્વાદ.

—આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ.

વડીલોને નમ્ર નિવેદન....!

શ્રી સતપંથ બાલ શિક્ષણ સંસ્કાર શિબિરમાંથી બાળકોએ ધર્મનું શિક્ષણ અને સદ્ગુણો પ્રાપ્ત કર્યા છે. તેમાં દિનપ્રતિદિન વધારો થાય તે હેતુથી આપણા સતપંથ બાલ-શિબિરના જન્મદાતા શ્રી શામજીબાપા તેમજ સાથી મિત્રો આપના ગામમાં ટુંક સમયમાં શિબિરાર્થી બાળકોની મુલાકાત માટે આવવાના છે. તો ગામના વડીલો, મુખીઓ, આગેવાનોએ આવનાર પ્રતિનિધિ મંડળની સાથે રહીને આ સત્કાર્યમાં જોડાઈ સહભાગી થવા મારૂં (આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ) નમ્ર સૂચન છે.

શિબિરોમાં બાળકોની રૂબરૂ મુલાકાત લેતાં જોવા મળે છે કે બાળકો શિક્ષણક્ષેત્રે પણ ઘણાં નબળાં છે. કેટલાક બાળકોને પોતાનું નામ લખતાં કે વાંચતાં પણ આવડતું નથી તો કેટલાંક વાલીઓ પોતાના બાળકો પ્રત્યે શિક્ષણક્ષેત્રે બેદરકાર રહે છે. આવી બેદરકારીનું પરિણામ વાલીઓ અને બાળકોને જીવનમાં ઘણું સહન કરવું પડે છે. તો શિક્ષણ અને સંસ્કારનો સુમેળ સાધીને સતપંથી સૈનિક બનો એજ શુભ આશીર્વાદ.

આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ
શ્રી સતપંથ પ્રેરણાપીઠ, પીરાણા.
તા. દસક્રોઈ, જી. અમદાવાદ-૩૮૨૪૨૫
ટેલીફોન STD | 02718-88-227
02718-88-229

realpatidar.com

https://archive.org/details/bk107/page/n37/mode/1up

realpatidar.com

Regd. No.............

એક થી દસ

સુરેશકુમાર એસ. પટેલ
C/o. શ્રી જ્યોતિ હાઈસ્કુલ
ખેડબ્રહ્મા (સા. કાં.)

એકડે એક, નિષ્કલંકની રાખો ટેક
મારા બંધુ કલ્યાણ લેવું સેલ છે.
બગડે બે, ગુરૂજીનું નામ લે...મારા બંધુ.
ત્રગડે ત્રણ, લે ગુરૂજીનું શરણ...મારા બંધુ.
ચોગડે ચાર, ગુરૂજીને નમસ્કાર....મારા બંધુ.
પાંચડે પાંચ, ભક્તિમાં ન આવે આંચ,
....મારા બંધુ
છગડે છ, ગુરૂજીની બોલો જય....મારા બંધુ
સાતડે સાત, નથી અમારી જાત....મારા બંધુ.
આઠડે આઠ, મુકી દે જગનો ઠાઠ....મારા બંધુ.
નવડે નવ, તરીજા તું આ ભવ....મારા બંધુ
એકડે મીંડી દસ, અધર્મમાંથી ખસ,
...મારા બંધુ
એવી રીતે ભજાય તો મુક્તિ ને પમાય....
મારા બંધુ કલ્યાણ લેવું સેલ છે...

Printed-Book Book-Post

From :-
સતપંથ જ્યોત
C/o. સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ-382425.

Pin 370001

realpatidar.com